

REGISTERED B. N. 156

# શ્રી જૈનધર્મ પત્રાંશ.

કર્તવ્ય જિનભદ્રન વિધિપર્દ્ધસંદ્રસન્માનસે: ।

સજ્જાચિત્તવિજ્ઞપ્તિ: પ્રતિદિન સથા: સરો સાધવઃ ॥

શ્રોતવ્ય ચ દિને દિને જિનબ્રચો મિથ્યાત્મનિર્નિર્ણાનં ।

દાનાદૌ વ્રતપાદને લ સતતં કાર્ય રતિ: આવકે: ॥

વિદ્યાનિષ્ઠ તત્ત્વજ્ઞાને હાંથી ઉદ્વિસ્ત અનવણા આપકેએ અતિના કો જિને  
કંને પદ્ધતિ દર્શાવતું અતું આપનું મુલિરલેની સંદર્ભાનું એવાં અને વા-  
નાનિષ્ઠ ( દાન, શાલ, દાપ અને બાળના ) ને દ્વિપ તથા અદ્વિતીય નાને પાપામન નિર-  
નાર આસ્ક્રિપ્ટ રજ્જવા ।

સુભામૃતાચલિ ।

પુસ્તક નં. મુખ્યમાં સંખ્ય ૧૮૫૬ શાક ૧૯૮૨ માઝે ૨ લ.

માગદુકસ્તા

શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર,

ધ્રુવી લાગ .....	.....	38
દો તાનસાર સુખ ચિવરાય .....	.....	34
નગાય યત્તાનો અનબા .....	.....	43
શ્રી વિદ્યાનિષ્ઠાનું મનોનારાનનમાણ .....	.....	42
આર્મિંગ પ્રભાતાન .....	.....	49

જાવનગર—આનંદ પ્રીન્ટિંગ પ્રેસમાં છાપુણ

વાર્ષિક મુલ્ય રૂ. ૧૨ ) ગેસટેજ ચોર આના.

## શ્રી નિષાઠિ શાલાકા પુરુષ ચરિત્ર મણ.

પર્વ ૧૦ સું.

બાધુસાહેણ દાયખુધસિહલુ બહાદુર તથા શેડ વીરથંહસાઈ હીપચંહ સી. આધ.  
ધ. ની મદદથી અમારી સભા તરફથી પ્રગટ થતા ઉપર જ્ઞાયેલા મહાન થાંથોનો  
ઘડોં (છેલ્લો) વિભાગ બહાર પાડવામાં આવેલો છે, તેની અંદર કાગળો ઘણા ડાચા  
વાપરવામાં આવ્યા છે, બાઈંડિંગ ઘણું સુંદર કરવામાં આવ્યું છે, અને સુંબદ્ધના  
પ્રસિદ્ધ પ્રેસ નિર્બિયસાગરમાં છપાવેલ છે; તે સાથે શુદ્ધ કરવા માટે પુરતો પ્રયોગ  
કરવામાં આવ્યો છે. સંસ્કૃતના અભ્યાસી દરેક સાહુસાહેવીને તેમજ લગેલા પુસ્તક  
ભાંડરને લેટ તરિકે આપવામાં આવે છે. પુરતકભાંડરના સેકેટરીએ પોસ્ટેજ મેડલી  
આપવાની કૃપા કરવી. અન્ય ગુહદસ્યો માટે માત્ર હોઠ રૂપીએ કિમત રાખી છે.

### નવું કેન પંચાંગ.

સંવત ૧૯૬૬ ના ચૈત્રનથી સંવત ૧૯૬૭ ના ક્ષાગ્રથું સુધીનું મહુંમ શેડ જો  
કાગલાઈ સુણચંહ—એનોની હંચા પ્રમાણે તેમના સુપુત્રે સુંબદ્ધમાં ઝા. ૧૩૫૦૦૦  
ના ખર્ચથી કેન બોડીંગ બાંધી કોમની મોટી જરૂર પૂરી ચારી છે તેમના સુંદર  
દ્રાટા સાથે ગુજરાતી પ્રેસમાં ડાચા કાગળ ઉપર શુદ્ધ છાપેલું અને સુશોલિત કરેલું  
પંચાંગ જીનથંદું આપેને માટે અગેલે બહાર પાડેલ છે. કિમત માત્ર ઝા. ૦-૦-૬ છે.

### લાઈઝ મેન્યુરોને મળવાનો નવો લાલ.

શ્રી કૈન ધર્મ પ્રયારક સભાના લાઈઝ મેન્યુરોને જીચે જ્ઞાયેલી ઘુડેં લેટ  
તરીકે મેડલવાનું થર્ડ કરવામાં આવ્યું છે.

- ૧ શ્રી સિદ્ધુસેન દિવારકૃત થાંથોના (ત્રણ થાંથોના સંથરુ)
- ૨ શ્રી ચંદ્રશેખરવિજયજીકૃત થાંથોના (દશ થાંથોના સંથરુ)
- ૩ શ્રી નિષાઠિ શાલાકા પુરુષ ચરિત્ર મણ. પર્વ દશમું, (શ્રી મહાવીરવાભી ચરિત્ર)
- ૪ શ્રી પ્રમેધ ચિત્તામણુ મૂળ.
- ૫ શ્રી કૈન ધર્મ અકાશ બયુલીલી અંક.
- ૬ શ્રી અધ્યાત્મ કલ્પદુમ વિવેચનયુક્ત.
- ૭ શ્રી ઉપરેશ પ્રાસાદ ભાષ્યાતર લાગ ૪ થા. ઝા. ૧ બંધાદ કરતાં ઝા. ૧ ધી.
- ૮ શ્રી ગૌતમસ્વામીનો રાસ અર્થ સહિત.
- ૯ શ્રી પુન્યપ્રકાશનું સ્તરવન.

## श्री जैनधर्मप्रकाश.

ततः प्रसन्नहृदया गुरवस्तेत्यो गृहस्थावस्थोचितं साहुदशायोग्यं च प्र-  
तिपादयन्ति धर्ममार्गं । ग्राहयन्ति तद्वार्जनोपायं महायत्नेन । यक्षुत ज्ञो  
जडाः सर्वर्मसाधनयोग्यत्वमात्मनोऽन्निदेवद्विर्भवद्विदमादौ कर्तव्यं ज्ञव-  
ति । यक्षुत सेवनीया दयाद्वृता । न विधेयः परप्रस्त्रिवः । मोक्षव्या कोपनता । व-  
र्जनीयो दुर्जनसंसर्गः । विरहितव्यालिकवादिता । अन्यसनीयो गुणानुरागः ।  
न कार्या चार्यबुद्धिः । त्यजनीयो मिथ्यान्निमानः । वारणीयः परदानन्द-  
द्वापः । परिहृतव्यो धनादिग्रवः । विधेया द्वुःस्थितद्वःखत्राणेष्टा । पूजनीया  
गुरवः । वंदनीया देवसद्ब्याः । सन्माननीयः प्रस्त्रिनः । पूरणीयः प्रणविदोकः ।  
अनुवर्तनीयो मित्रवर्गः । न ज्ञापणीयः परावर्णवादः । शृहीतव्याः परगुणः ।  
द्वजनीयं निजगुणविकल्पनेन । स्मर्तव्यमणीयोऽपि सुकृतं यतितव्यं परार्थं ।  
संज्ञापणीयः प्रथमं विशिष्टद्वोकः । अनुमोदनीयो धार्मिकजनः । न विधेयं  
परमर्मोद्यवृत्तं । ज्ञवितव्यं सुवेषाचारैः । ततो ज्ञविष्यति ज्ञवतो सर्वज्ञसर्वर्मानु-  
ग्रान्योग्यता ।

પુસ્તક રડ મું. વૈશાખ સ. ૧૯૬૬ શાકે ૧૯૩૨. અંક ૨ બો.

ॐ अहं नमस्त्वायः

इष्टर्या त्याग.

( २१६८ वि० घ० )

મોહે વ્યાદુણ ચિત મર્કટ સમા અજીન ટાંડ હુંઘી  
 પ્રીતેથી અસ્સુયાછિ કાષ ખડકે ઈચ્છા થવાની સુખી;  
 વેરાજયાહિ સુવાસિ આત્મ પદ તે જેથી બુઝો પરજણે,  
 તે ઈધ્યા સથાપી સમાન સળગે સંક્લિશ દ્વેષાનણે;  
 તેના જે પ્રતિપક્ષી મેધ સરખા થુદુ ત્વલાવે લર્હી,  
 શાન્તિથી પ્રશંસ મ્રવાહુ પ્રસરે તે વૃથિથી સંચર્યો;  
 લોકાલોક પ્રકાશ શીતળકરા દ્વેષભિને ડારતા,-  
 તે વંદું જિનનાથ સાથ શિવના લાવારિસંહારતા.

૩૬

## જન ધર્મ મદાશ

ગ્રીતવદી અંધાણીરે અલુત જિણું હશું. એ—૨૧૭.

ઈંધ્યાં એ અંપલક્ષણ મોડું લુવમાં,  
નિષ્કરણ અરાને બાંધ કર્મને;  
કાલ અનાદિ કુવાસિત ભતિ મિથ્યાત્વની,  
નેથી ન જણ્યો શુદ્ધ સ્વલાવિક ધર્મ ને.      ઈ ૧

સતુ શાસ્ત્રોથી જહૃગૃહ ભાષ્યું સાંભળ્યું,  
લુચ અશુચ ચેતન જડ લક્ષ્ય લિજ ને;  
તો પણ શરૂઆ હીન હૃદય શૂન્યે કરી,  
પર સંપત્તિ હેઠી થાતો ખિત્તને.      ઈ ૨

નેર અવિદ્યા ડેડં જળદં કરુ વિષે,  
ક્ષાળુભંગુરને માને શાશ્વત નિત્ય ને;  
આત્મ અનાત્મ વિરુદ્ધ સ્વલાવે સદ્ગે.  
નિર્મણ ભણમાં વિપરીત લેનું ચિત્ત ને.      ઈ ૩

યોગી જને બહુ વર્ષન ભાષ્યું કલેશનું,  
સમજવા અધિકારીને ઉપકાર ને;  
વસ્તુ યથાર્થનું જાન થયું વિદ્યાવડે,  
(તે) સુશુર સુનજરથી નિજ અનુભવ સુણ સારને.      ઈ ૪

દ્વા મતસર અસ્યા ઈંધ્યાં વળી,  
દોષ અહું મમ લાવ પચોય અશુદ્ધ ને;  
મોહ વિપર્યાસે એ ભૂત અનાદિની,  
દ્વાળે જાની જાનવડે સુવિશુદ્ધ ને.      ઈ ૫

ઇંધ્યાથી પરવસ્તુ પર ઉદ્વોગથી,  
પામે પોતે દ્રોગટ મન સંતાપ ને;  
જવર સમ વ્યાધિ તનમાં વ્યાપે તેદ્ધથી,  
ખાર અહ્યાની પડે જગતમાં છાય ને.      ઈ ૬

ખાતાં પીતાં વાન વળે ન શરીરનું,  
ઇંધ્યાનિથી અંતર ભળી થાય ખાય ને;  
પેટ મશળીને શૂળ કરે અરાનથી,  
લીધિાળી વાંબે ન મળે કંઈ દ્રાક્ષ ને.      ઈ ૭

અહુનિશ્ચ શુરૂપદ સેવી શિક્ષા માનવી,  
કર્યા કર્મ અનુસારે ઇળ નિરધારને;

## ज्ञानसार सूत्र विवरण.

३५

जाणुने संतोषाभृतथी सुभीया थवुँ;

परम रसायन धर्म सदा सुभकारजे.

४० ८

श्री जिनवरल्ल उपशम आदरवा क्षेत्र,

नैन सेवकने दृच्छ निरंतर तेह ज्ञे;

श्री जिन सहश्रु अक्षित मून्य प्रसायधी,

धृष्ट श्रेष्ठ शुणुस्थान कुमे शिव गेहु ज्ञे.

४० ९

“ ए ‘दी चोणी लकड़ा भट्का कुरतां चाल्या—ए राणा,

शाने माटे ! धर्याभिथी मन बाणे,

डे’ने लाई डेण्यु ? बीजुं अंतर परब्जें;

मत्सरना रे उत्कर्ष, सङ्खनना रे अपर्कर्ष;

मोहान्धाये ठांड न बाणे

शाने० १

समलु हुवे शाणु थाने, सहश्रुने शरणु ज्ञने;

चिते चेती ले धर्मशिक्षा, संतोषे सुभी सर्वकाणे,

माटे डाह्या थेने कृ प्रीति शमनी आये.

श्री कुर्षुर विजयल जैन लालभ्री. माणुसा.



## ज्ञानसार सूत्र विवरण.

इंद्रिय पराजयाष्टक ( ७ ).

( अनुसंधान ४४ १६ थी ).

ज्ञवासधीविमुभ थयेला साधुजनोये पणुविषय विकारथी केटलु अधुं सावचेत  
रहेवानी जड़र छे ते शास्त्रकार चोतेज ज्ञाने छे.

आत्मानं विषयैः पाञ्चनैववासपराढ्मुखम् ।

इंद्रियाणि निवन्तंति, मोहराजस्य किंकराः ॥ ४ ॥

ज्ञावार्थ—संसारधर्मनथी चक्षित थर्ध गचेला त्यागी पुरुषने पणु भोग  
राजनी आणुमां रहेनारी इंद्रिया विषयपाशवडे नियंत्री ले छे, तो भीज्ञ ज्ञवा-  
भिनंदी प्राणीयाने पाशमां पाडी नांगे तेमां तोः क्षेत्रुं ज शुं ।

विवेचन—विषयासक्तिथीज राग द्रेप अने मोहाहिकनी उत्पत्ति थाय छे,  
राग धाहिक विकारथीज अष्टविषय कमंनी रथना थाय छे, अने ए अष्टविषय कर्मना

योजे छवने नंसारमां जन्मभरणुहिक हुःण सहेवां पडे छे; तेम छतां छव विषयासकित तलु हेतो नथी, विषयरस याभवानो छुवने अनादि काणो अस्यास छे, अने तेथी परिशुभेजे के छुवने अनंता हुःभ सहेवा पडे छे तोपषु ‘भद्रुभिंदवा’ नी केम ते विषयरस तलु शकतो नथी. भद्रुभिंदवातुं दृष्टांत मसिझु छे, अने ते परिशिष्ट पर्वमां विस्तारथी उपनय साथे बतावेलुं छे. अद्गुरु अंसारी छुवने तुच्छ विषयरस तज्ज्वा उपहिंदे छे; अने समज्ज्वे छे के “हे लद! विषयसुभथी विमुख थध विषयनी पराधीनता तलु तुं तारा आत्माने आणाख. कस्तुरीया मृगलानी केम सुअने भाटे भिथ्या होडाहोड न कर. तारा आत्मामांज सहज अनंत सुण लर्यु छे तेनी तुं विषयस्ताथी प्रतीति कर अने तेनीज गवेषणा कर. अरी श्रद्धाथी आत्माना सहज सुअनी गवेषणा करतां ते तने तारा आत्मामांज भागी शक्षेहे; परंतु तेने भाटे अद्गुरु के जे शुल आलंभन सेववाना कहे तेनुं तुं सादर सेवन कर, अने के जे प्रमादाचरणु तज्ज्वातुं कहे ते तुं तरत तलु हे. शुल आलंभन सेव्या विना अने प्रमादाचरणु तज्ज्वा विना तुं कहापि साचुं सहज निरुपाधिक सुअ भेणवी शकीश नहिं. भाटे भद्र, विषय, कृपाय, निद्रा अने विकथाहिक प्रभादने हर तलु अहिंसा संयम अने तप लक्षणु शुद्ध धर्मतुं आलंभन दे. ये अनुपम धर्मने प्रभाद रजित सेववाथी पूर्वे अनंता छुवो. सहज निरुपाधिक अभ्युङ्क सुअने पाभ्या छे; वर्तमान काणे पाभे छे अने लविष्य काणमां पाभशे. जे ने महातुलावो तीर्थकरपटनीने पाभ्या, यावत् सकण कर्मनो क्षय करी मोक्षपदवीने पाभ्या ते जर्वे शुद्ध धर्मना प्रभावे पाभ्या छे.” अद्गुरुनी ओवी शिक्षा संलग्नी कहिं लव्य ज्ञो विषयसुभथी विषक्त थध विषयने विषवत् देखी त्वदित साधवा उज्ज्माणाथाय छे, त्यारे केटलाक प्रमादथस्त ज्ञो विषयरसमां सुंआयाथी तेनेज सार समग्र सद्गुरुनी पषुहितशिक्षाने अवगण्युविषयसुणमांज मग्न थध रहेहे. केटलाक लव्यानी ज्ञो छता लोगने तलु हे छे, त्यारे केटलाक लवालिनंही ज्ञो अछता लोगनी पषु अभिलापा राणे छेअने तेने भाटे तन मनतोडी भरे छे. ज्यांसुधी विषयवासना प्रभाग छे त्यांसुधी गमे तेटला हुँधी तेनेहाथी हेवा प्रयत्न कर्या छतां तदनुद्गुण संपेजो भगतां ते तरत लगृत थध लय छे. भाटे केम बने तेम विषयवासनाने निर्मूण करवा प्रयत्न करवो जेईअ. विषयवासना ज्यांसुधी निर्मूण करी नथी त्यां सुधी विरक्त साधुओने पषु निर्वित रहेवा केतुं नथी. केमके कंधिक छापा पाभीने मोहना सुलोटो तेनने पषु विषयवासनां पाडी नाप्ने छे; भाटेज सर्व प्रभाद तलु सावधानपषु विषयवासना निर्मूण करवा तपनायमतुं सेवन करी शुद्ध अहिंसक भावने योपी आत्माने रवस्वलाभमांज रमावयो थेअथ छे; पषु मोहवशा विरुद्धपषु वर्ती विषयविकारथी इनण आत्माने मलीन कराय छे, तेथीज जानी

## नानसार शूल विवरण्.

३७

पुरुषो विषयवासनाने तजवा-निर्भूण करवा भार मुक्तीने कहे छे; ते आत्माथी ज्ञेये अवश्य लक्षभां राखी परिशीलन करवा योज्य छे. ने संथमभां घरेखर ६६ छे ते महातुभावेऽन विषयवासनाने निर्भूल करी शके छे, अने ने स्वसंथमभां ६६ रही विषयवासनाने निर्भूल करे छे ते सांत ज्ञेना के सहज सुखनो अनुभव करे छे ते घरेखर निरवधि छे. कहु छे के “ सर्व उपाधिथी सर्वथा धृतेला, राग देवादिक तापथी मुक्त थथेला अने प्रशांत चित्तवाणा महातुभावेवे ने निरुपाधिक सुख पामे छे तेवुं सुख युक्तवर्ती पथ प्राप्त करी शकतो नथी. ” “ राग द्रेष अने भाषु विकारथी सर्वथा मुक्त थथेला वीतराणी पुरुषो ने सुख पामे छे ते तेभेऊ जाणे छे, अन्य कोई ते जाली शकतो नथी. केमडे विष्टामांज भग्न रहेनार सुकर सुरलोकना सुखने शी नीरे जाणी शके? ”

जे ज्ञेवा कामांध छे ते निःशङ्कयेणु विषयसुखमांज रमे छे, अने ने जिन वचनमां रक्त छे ते लवलीड ज्ञेना तेथी विश्वेमे छे. केम गेणमां पडेली भाखी पोते पोताने मुक्तवासा समर्थ थर्थ शकती नथी, तेम विषयरसमां इयेला माणुस पथु तेमांथी मुक्त थर्थ शकता नथी. समर्थ एवा जानी पुरुषना हस्तावलं अननी तेमने अवश्य ज़रूर रहे छे.

पाशवटे अने पञ्जरवटे वैयपगा जनवरो अने पंभीओ वंधाय छे तेम शुवतीरूप पांजरामां पूरायेला पुरुषो कलेशने पामे छे. शुवती जननी साथे संसर्ग करनार हुःण वहारी दो छे. केमडे जिवाडी साथे संग करतां मूष्ठने सुखहोइ शके. ७ नहि. हरि हरि थक्का चांद सूर्य अने कार्तिक स्वामी विजेवैलाकिक हवे. पथु ओच्चोनुं हासतव करे छे, माटे विषयतुष्णुने धिक्कार छे. “ श्री संभधीविषयसुखमां आसक्त थथेला भूल अने. शीत तापादिक सहन करे छे, विवेकशून्य थर्थ एलान्दी पुनर्नी पेरे स्वज्ञतिने तलु हे छे अने रावधुनी पेरे स्वल्पवितने पथु तजे छे. ” विषयतुष्णुने वश थधने लुव एवा प्रन्थक्ष पाप करे छे के ने तेमने प्रकाशवा अहु सुरक्षेल पडे छे अने लुवित पर्यंत शत्यनी पेरे साले छे.

सर्व द्वितिक्षिक्षानो सार ए छे के, सुझ ज्ञेये संतोषवृत्ति धारी, तपसंयमनुं यथाशक्ति सेवन करी, विषयतुष्णुने तजवा भ्रयतन कर्वो नेइओ. एम करवाथीज सहज सुख प्राप्त थर्थ शकेय, अने अंते परम हित थरो; मन तथा धृद्रियोनो नियहु क्योंथीज परमश्रेय प्राप्त थर्थ शके छे. यतः

मनपरणेंद्रियमरणं, इंद्रियमरणेण मरंति कम्माइ ।

कम्ममरणेण मुख्यो, तम्हा मणमारणं पवरं ॥

अर्थात्—मनने मात्रवाची ईद्विद्यो सहेजे शांत धाये हे, ईद्विद्यो शांत थर्ज ज्वाली राग द्रेपाहिक लालगर्भं तथा मेहाहिक द्रव्य कर्मनो गणु लय धाये हे, अने कर्मनो लय थवाची मोक्षपद प्राप्त थाये हे; माने मननेज मारवुं—वश करवुं जड़-रवुं हे. श्रीमद्विनिधिज्ञलु उपाध्याये मन तथा ईद्विद्येना निशुद्ध अनुचरणा सांखंप्रमां कठेलुं गव मनन करवा लायक हे. ते आ प्रभावो—

“ पांचे योआ औंक रथ बुआ, सालेण उसका भीतर सूता ॥

जेदु उसका महमत वारा, योहेदुं दोरावनहारा ॥ पांचो० ॥ १ ॥

द्वारे लुडे ओर ओर याए, रथकुं द्विरि द्विरि उवट वाए ॥

विषम पंथ चिदुं ओर अधिसारा, तोली न लगे साडिण ख्यारा ॥ पांचो० ॥ २ ॥

जेदु रथकुं इर दोरावे, गोणणर साडिण हुँण पाए ॥

रथ जंगलमां लय असुजे, साडिण सेवा कछुआ न युजे ॥ पांचो० ॥ ३ ॥

योर ठोरे उहां भीती आये, दोनोहुं महायाता पाये ॥

रथ जंगलमें जीरण दीना, मात धनोका उहारि दीना ॥ पांचो० ॥ ४ ॥

धनी जाग्या तथा जेदु आंध्या, राज्यी पराना ले शीर सांध्या ॥

योर लगा रथ मारग लाया, अपना राज विनय लडे पाया ॥ पांचो० ॥ ५ ॥

आ पदमां अंतुं दृपक षतांव्युं हे के—शरीरदृप रथने पांच ईद्विद्येऽप्य पांच योआ जेवा हे, आत्मा एज तेनो स्वामी ते रथमां सुतो हे, मन एज तेनो सारथि हे, ते स्वामिनी निर्गणतानो लाल लक्ष ईद्विद्येऽप्य अश्वेने पोतानी ईच्छा मुजभ उवट रस्ते लक्ष ज्वालीने ऐहाल करे हे. विषम वाटे जलां मार्गर्भां राग द्रेपाहिक योरटा मगे हे, ते स्वामीनुं सर्वस्व लुटी लक्ष रथने पषु लुर्ष करी नाए हे. पोतानी आवी हुक्षा थयेती लेक्ष-लाली स्वामी लगी उडे हे, अने अहमुद्दि दृप राश तथा पुरुषार्थदृप परोलेणा ह्याथमां लक्ष मन तथा ईद्विद्येऽप्य आरथि तथा योआने कण्ळनामां आणु हे, अने पढी तेमनी सहायथीज पोतानुं सर्वस्व पाषुं प्राप्त करे हे. मतवत्र एवी हे के—मन तथा ईद्विद्येने वश थर्ज ज्वाली आत्मा राग द्रेप तथा मेहाहिक विकारेशी पोतानुं सर्वस्व शुभावी हेहे, अने एज मन तथा ईद्विद्येने रववश इरवा राग द्रेपाहिक हुए दोपेने हर करी आत्मा अक्षय सुखने प्राप्त करी शडे हे. विष्यसुखमां आसक्त थयेला अडारनी जेठी वस्तुमां गुंजाई नय हे, अने ले पोतानीन अरी वस्तु पोतानी पासेज होय हे तेने भूती नय हे. तेज वात शाक्कार भवावे हे—

गिरिमृत्सनां धनं पश्यन्, धावतींद्वियमोहितः ।

अनादिनिधनं ज्ञानं, धनं पार्वते न पश्यति ॥ ५ ॥

**भावार्थ—** इन्द्रियसुखमां मोहित थयेलो शुक पर्वतनी माटीने धन मानीने ते लेवा दोडे छे; परंतु अनाहि अनंत ऐवुँ ज्ञानरूप धन पोतानी पासेज छे ( पोतानाज धरमां छे ) तेने ते जेतो नथी. प.

**विवेचन—** पाचे इन्द्रियेना विषयसुखमां मुंजाई गयेला शुक ते कविपत सुखना साधनस्त लक्ष्मीने माटे पर्वतमां रहेली नाना प्रकारनी धातुओनी खाण्डे के माटी जोही तेमांथी लक्ष्मी पेटा करवानी आशाथी होउधाम करे छे, तेने माटे अनेक प्रकारता पाचारांस करे छे. वणी लुण, तुषा, टाठ, तडका सहन करतो कंठ-चित् भरण्यांत हुःपने पणु पामे छे. असे धारेली लक्ष्मी भगे छे अथवा नथी पणु मणती. कवित डवित लाल पणु थाय छे; अने हुनि पणु थाय छे. परंतु मोहवश थयेलो ग्राणी पोतानुँ धार्युं करवाने केटलो अने तेटलो प्रयास गमे तेटलुँ ज्ञेयम जेत्तीने पणु उडावे छे. केम आंणमां घीणीओ [ कमगो ] थई ज्वाथी सर्वन पीणुँ पीणुँ ज हेणाय छे तेम मिथ्यात्व मोहुथी परवश थयेला विषयासङ्कल शुक पणु ज्यां लां सेपुंज देणे छे, अने ते लेवाने विवेकविकला अनी द्विवानानी पेरे होडे छे. पोतानाज पासे सार वस्तु छे तेतुँ तेने लान पणु नथी, तो तेने माटे आदर तो छायज शानो? ज्यां सुधी मोहुनी झुमारी यढी छाय छे लां सुधी आवीज हुर्दशा अने छे. ज्यारे मोहुनुँ नेर नरम पडे छे लारे विषयासङ्कित वटे छे अने लाजयोगे सत् समागम भगे छे. लारेज भद्रशुद तेने सहुपदेशवटे पारडी आशा तजवा अने पोताने स्वाधीन ऐवुँ ज्ञानाभृत पीवा योध आप छे. पथा—

आशा ओरनको कुया कीने, अवधु ! ज्ञान सुधारस पीने, आशा० लटके द्वार द्वार लोकनके, कुकर आशाधारी;

आतम अनुभव रस के रसीआ, उतरे न कुभु झुमारी, आशा० १ आशाहासीके जये, ते जन जगके हासा;

आशाहासी करे जे नायक, लायक अनुभव ध्यासा, आशा० २ मनसा ध्याला प्रेम भसाला, अस अनिन परलकी;

तनभारी अवदाई पीछे कस, लगे अनुभव लार्वी, आशा० ३ अगमपीआला पीछो भतवाणा, चीन्ही अद्यतम वासा;

आनंद धन येतन वही ऐले, हेणे लोक तभासा, आशा० ४

ये महापुरुष ज्ञाने छे के—“ पारडी आशा विषयतुपणु—परस्पुहा विष नेवा हुःभद्राथी छे. विष्यरसना आशी ज्ञो झुकरनी पेरे डाम डाम लटकी विष पनी लिक्षा माजे छे, डेक्कें डेक्कें अपमान पामे छे, विविध प्रकारनां कष सहे छे,

तोपछु ते परआशा तजता नथी. परस्पृहा समान कोई हुःअ नथी अने निःस्पृह-  
ता समान कोई सुख नथी, ए सुखहुण्ठु' संक्षेपधी रवदृप कहु छे. आवा हि-  
तवचनधी युझ महाराज लब्ध शुभने जोये छे अने कहे छे के-ज्ञेकांत अहितकारी  
परआशा तलु रवाधीन ओवुं ज्ञानाभृततुंज सेवन करवुं व्येकारी छे. ज्ञानाभृततुं  
पान कथो विना परस्पृहा भट्टावानी नथी. ज्ञानाभृततुं सेवन करी लेखे परस्पृहा  
तलु दीधी छे तेन अनुबवरसनी-शांत रसनी भरी खुमारी जगेछे अने तेखुमारी  
कहापि उतरती नथी. जेने भरी खुमारी जगी छे ते जेम रवानुबव रसनी पुष्टि  
थाय तेम तन मन वचननो सहुपयोग करे छे, तेनो कंधं पछु हुँपयोग करताज  
नथी. छेवट सर्वं स्पृहाने तलु तेवण निःस्पृहपछे सर्वथा रवपर हित करवा उज-  
माण रहे छे. जे विकरण शुद्धिधी जगत्मानतुं हित करी शके छे, ते नयथी शीघ्र  
सुधी रवानुबव रसमां मन रहे छे, मतवाप के सदगुरता हित वचननो आहर  
करी परस्पृहाने विषवत् देखी जे तके छे अने अभृत समान अनुबव ज्ञाननो जे  
अब्यास करे छे ते सर्वं विग्यविकारने टाणी जाहज समाधिसुखने ग्रास करे छे.  
ज्ञेवा तात्त्विक सुखने कोणु न अलिलयं? भोक्षार्थी ज्ञो तो ते अवश्य अलिलयेज.  
इकत भावाकिनंही ज्ञेनाज तात्त्विक सुखने तिलांकवि हाह विषयतृप्त्यानो आहर करे  
छे.” शाश्वतारे इन्हुं छे के “जे जिन वचनाभृतनो आनाहर करी, लव विड्यनाकारी  
घोर विषयरसने सेवे छे तेमने वारंवार धिकारे छे.”

“जे भाषुसो मरणांते पछु हिन वचन योक्ता नथी ते पछु स्नेहुरागधी घेला  
भनी स्त्रीआ पासे बाणचेष्टा करे छे.” “इद्र पछु जेतुं मान-महत्व अंडी शके  
नहि तेवा भाषुसोने पछु स्त्रीआपे पोताना दास जनाव्या छे.” जेम असि  
पासे रवावेज भीषु ओगणी जय छे तेम ज्ञोना जांसर्गथी-परिचयथी मा-  
णुसनुं मन द्रवी कामातुर थर्य जय छे. “सिंह, सावज, डाढी अने सर्वांहिक अति  
हर ल्लोने सुणे लुती शकाय छे, परंतु मोक्षमार्गमां विक्षिकारी एड कामनेज ल-  
तयो मुश्केल छे. जेखे कामने लुयो तेषु सर्वं लुत्युं छे.” “जे आ हुर्ल भा-  
नवस्तव यामीने रवात्मशुद्धि करवा मन वचन अने शायानो निश्चह नहि करतां के-  
वण धर्मद्विधना विषयसुभामां निभग्न रही योताना आत्माने रागदेवाहिक वि-  
अरवटे उकटा मदीन करे छे ते भांदासारी ज्ञो योतानाज गणा हिपर कातर वाहे  
छे.” “जेथी लुव अभृत समान धर्मने विषवत् ल्लोने छे अने जिय जेवा वि-  
धम विषयलोगने अभृत जेवा देखी आहरे छे तेथी ज्ञानाय छे के ते अंध अनी  
गयो छे अथवा तेषु धर्मार्थी योग्यो छे अथवा संशिपातथी तेनी डागणी खसी गई  
छे.” ते ज्ञान विज्ञान के शुण्डिंभर शा कामना के विषम ज्ञेवा विषयलोगमां रायी

ज्ञानसारं शूलं विवरणम्.

४२

अते नरकाजिनमां जह पचाहुँ पडे ? तेथी शास्कारे युक्ताज क्लुँ छे के “ के लुप रंभाव विषयसुखने माटे मनुष्यपाणुँ हारी नाय छे ते भस्मने माटे जाशीर्व च-हनने बाणे छे, आगने माटे ऐरावणु हाथीने वेचे छे, अने कवचवृक्षने तोडी ओ-र तो वारे छे: अर्थात् आ अभूत्य भनुप्लव एवी रीते एणे शुभाववाने माटे नथी.” “ वणी लुविततुँ अस्थिरपाणुँ, आयुष्टुँ परिभितपाणुँ अने मोक्षसुखनुँ अक्षयपाणुँ व्याणीने विषम एवा विषयलोगथी विरमधुंज लेइच्ये.” सुमुक्षु ज-राने केवी पांच ईद्रियो दुर्ज्य छे तेवी धीजु डोइ वस्तु सकल जगतमां दुर्ज्य नथी.

आ जगतमां थयेला एकज वीर एवा श्रीवीरप्रभुचे इरमाठ्युँ छे के—सुमुक्षु जनोच्ये निर्भूत ज्ञान वैराग्यथी भनने स्थिर करी पांच ईद्रियोने इमजे रापवी अने जेम ज्ञान वैराग्यादिक उत्तम शुण्हानी पुष्टि थाय तेम अनुकूल प्रयत्न सेवयो. एवा प्रकारनी परम हितकारी श्रीवीरप्रभरमात्मानी आपेक्षी शिक्षाना अनादर करी के भद्रकारी जना आपमतिथी अवणा थाके छे ते क्षणिक एवा विषयसुखमां मुंआई महा व्यथाने पामे छे, अने अभूत समान ज्ञानादिकना उत्तम लालक्षी सदा जेनशीष रहे छे. तेज वात अंथकार जणावे छे—

पुरुषुः स्फुरत् तृष्णा, मृगतृष्णानुकारिषु ।

इन्दियार्थ्येषु धावन्ति, त्यक्त्वा ज्ञानामृतं जडाः ॥ ६ ॥

**लानार्थ—**आगण आगण स्फुरतृष्णायमान थती तृष्णावडे अंतवाना जण जेवां विषयसुखने माटे जड लेडो ज्ञानामृतनो अनादर करीने होइधाम इरेछे. ६

**वितेचन—**जे पांच ईद्रियो योताने पूर्वपुष्टययोगे सांपडी छे तेनो दुर्लभ मानवबन पानीने डेवो सहुपयोग करवो ज्ञेय, ते सम्यक् ज्ञानना अलावे नहि जाणनारा अने भित्या भाषु (अज्ञान) योगे उलटो तेनो दुर्लपयोग करनारा जड लेडो जेम जेम उपरित्थ थयेला ईद्रियोना विषयोमां रति (प्रीति) वडे प्रवृत्ति इरे छे, तेम तेम संतोष वणवाने घटके विषयतृष्णा वधतीज नाय छे. जेम जेम तृष्णा वधती नाय छे, तेम तेम मूढ आत्मा विषयसुखमां वधारे वधारे सुं-आई ते क्षणिक विषयसुख माटे अधिक प्रयत्न इरे छे, अने ए प्रकारे विषयसुख-मांज आसक्त अनी योतानी अधी छुंहगी अरभाद करे छे; तेम इतां परिखासे सं-तोष विना सुख पार्ही शक्तो नथी, अने हुए तो तेमां डगले डगले अनुलववां पडे छे, तोपय मूढ ल्लयो ते मधलाण तलु शकता नथी. अहय माव कवचित् सुख ने माटे मूढ प्राणीच्यो अनहय सुख हारी नाय छे. संतोषवंतनेके सुख द्वालाविं रीते प्राप्त थाय छे, तेनो विषयांध लुवने गंध सरओ पण आवतो नथी, त्यारे

संतोषी छुव चेताने यक्षर्ती करतां पशु अधिक सुभी लेजे छे. तुम्हि आष्टकमां कळु छे के—विषयलोगाथी अतृप्त एवा ईंद्र के उपेंद्राद्विक पशु सुभी नथी. हु-नियामां सुभी मात्र ज्ञानाभृतथी तृप्त अने निरंजन कर्मकवक्ती सुकृत थेवा एवा सुनिज्जनाज छे. “निसःपूरी निराशी निरोली संतोषी साधु यक्षर्तीथी अ-धिक सुभी छे.” ज्ञानाभृतथी ते सहा सुप्रसन्न रहे छे. ज्ञानज अलिनव अभृत, अलिनव रसायण अने अलिनव ऐर्धर्थ छे. ते ने लब्ध्यनने प्राप्त थयेक छे तेज घरा सौभाग्यी छे. एवा अपूर्व ज्ञान विनाना माण्डेसो पशु चरणाज छे. माटे अ-भूद्य मानवलव पामीने एवुं अपूर्व ज्ञान-आत्मज्ञान-अनुसवज्ञान प्राप्त करवा पूरतो प्रयत्न करवो ज्ञेयम्. आत्मज्ञान आत्मातुलभी योगियाना अनुयाही प्राप्त थर्ह रहें छे. एवा महात्मायानो अनुग्रह योग्य लुचेने थाय छे. येवी योग्यता विषयासङ्गित विषयविकार-विषयवासना तलु सद्गुरुनी यथाविधि उपासना करतां सहेने संपर्के छे. ने ज्ञेना विषयादिक प्रमाणने वश थर्ह सत् समागमथी लिमुण ज रहे छे तेमने तो आहार, लय, मैयुन अने परिवहरूप संसाचतुष्कथी पशुनी चेते स्वल्पवन समाप्त करवानुं थाय छे. पशुवृत्ति तेमने प्रिय लागे छे, तेमांज ते रन्यापच्या रहे छे. आत्मगुणु प्रति तेने लक्षण छेतुं नथी. तेथी आत्मानी तत्त्विक उज्जितिनो मागं जाणुवाने के आहवाने ते तमा राखता नथी. आवा पामरज्जन उ-पर सहशुद्धनो अनुग्रह थर्ह शकतो नथी. डेवण पशुवृत्तिवडे लुवनारा लेडो. स्वप-रहित साध्यवाने डोऱ्ह दीते अधिकारी थर्ह शकता नथी. तेमनी सर्व शङ्किल ज्ञेणे रस्तेज अर्चाई लाय छे. सहशुद्ध प्रासि माटेने मननो, वयननो अनेकानो सहृपयेग करवो ज्ञेयम् तेने अहवे ते तन मन अने वयननो विषयेंद्रियेने चेष्यवाने माटे जेरड-पयेग करी; विषयनणमां शुंथाई अह, इवित सुभमां लक्ष्याईने सर्व सत्सा-भवीने डेवण निर्झूल डरी नाअे छे. पोतानीज निर्झूलाथी विषयनणमां क्षायेला पामर प्राणीयो साचा सुखनो गंध पशु क्यांथी पामी शके ? कळु छे के “ स-त्य श्रुत शीण विज्ञान तप अने वैराग्य ए सर्व क्षणमात्रमां विषय दृप विषना येवो मुनि पशु गमावी दे छे. ज्यारे मुनिमहात्माने पशु विषयसंगथी आटली अधी हानि थाय छे त्यारे विषयसुभमांज रन्यापच्या रहेनार ईतर असा ज्ञेनानुं तो क-हेतुंज शु ? ” तेथीन शास्कार लुचने वारंवार एवीज डितशिक्षा आपे छे के “ रे भूठ लुव ! स्वमितिक्वित क्षणिक सुभमां लुण्य थर्ह तुं शामाटे अंद्रमा समान उज्ज्वल यशने अने निरुपम एवा अक्षय सुखने हारी लाय छे. ” अक्षय अनुपम एवुं मोक्षसुख ज्येथी साधी शकाय एवी अनुद्गण सामवी पुनःपुनः मालवी मुश्केल छे. तेने तुच्छ विषयसुखनी आतर गमावी देवी ए केवण भवि भूता छे. केमडे तेवा भातभाद्यी गमे तेटली उच्ची लहे यडेला पुत्रपने पतित

નવાળું યાત્રાનો અનુભવ.

૪૩

થતાં વાર લાગતી નથી. કહું છે કે “ વિષય અજિન પ્રજ્ઞાલિત થયો સતો ચારિતના સંપૂર્ણ જીવને આળી નાળે છે અને સમૃક્તલિતે પણ નષ્ટ કરી જીવને અનંત સંસારીનાનાંતરાણ પર્યાંત સંસારએકમાં પરિશ્રમખુરીણ જનાવે છે. ”

આ જ્યાંકર લખાણાટવીમાં જીવોને એવી તો આકરી વિષયતૃપ્તિ જાગે છે કે જેથી ચ્છાદપૂર્વી સરખા સમર્થ જીવને પણ નરકનિંગોદમાં અનંત કાળ પર્યાંત રાજીલું પડે છે. વિષયરસમાં આસક્તિ ધારવાથી જીવોની થતી અનંતી વિદ્યાના ખતાવી, તેવા ફુરાંત હુંઅધાર્યી વિષયથી વિક્રાંત થઈ જાંતેષ્વત્તિ ધારવા અને અજિન નવ અમૃત સમાન જિનવાખુંનું પાન કરવા આ શ્રોક વહે વ્યાંગમાં ઉપદેશ આપેલો છે તે સુર જનોએ સમજી રાખવા ચોણ્ય છે.

અપૂર્વી.

## નવાળું યાત્રાનો અનુભવ.

(અનુસંધાન ગૃહ ઉર્ધ્વ થા).

છરી પાળવી એમાં છ ને રી ચેવા એ શબ્દો છે. છ તો સંખ્યાવાચક છે પણ રી છએ પ્રકારની કૃથાયોમાં છેવટે આવતા રી અક્ષરનો સૂચક છેતેથી પ્રકારની કૃથાને માટે સંકૃત એક શ્રોક છે. તેમજ ગુજરાતી રૂપદમાં તેના અર્થવાચક શબ્દો છે. સર્વે વાંચનારાયાને ઉપયોગી થવા માટે ગુજરાતી વાક્યો આ નીચે બતાવવામાં આવ્યાં છે.

૧ એકલ આહારી—દરરોજ એકાસણું કરવું.

૨ સચિત પરિદ્ધારી—સચિતનો સર્વથા લાગ કરવો.

૩ શુરૂ સાથે પરવારી—શુરૂ મહારાજની સાથે પગે ચાલવું.

૪ લોંય સાથારી—ભૂમિએ સુલું, ઢાલીઆપર ન સુલું.

૫ પ્રક્ષયારી—કાયાએ પ્રક્ષયાર્થ પાળતું.

૬ આવશ્યક હોયારી—એ ટંક પ્રતિકમણુ કરવું (શાધ દેવસી).

ધીલ રીતે પણ આ છરી ગણ્યાયેલી છે. તેમાં એ ટંક પ્રતિકમણુને સ્થાનકે સમક્રિતધારી એ છૂટી રીકહેલી છે. તેની વ્યાખ્યામાં સમક્રિત પણે, વિકાળ પૂજન કરે, એ ટંક પ્રતિકમણુ કરે ને પચ્ચાળાણુ કરે, એમ જણ્યાયેલું છે. આ છરીમાં એકલાહારી એટલે એકાસણું કરનારને સચિતનો લ્યાગ તો હોયા છે, તેથી તેને નુદી પાડવાનો

એકાહારી જૂમિસંસ્તારકારી, પદ્મયાંચારી શુદ્ધસમ્પત્તવધારી ।

યાત્રાકાઙ્ક્ષે સર્વસચિત્તહારી, પુન્યાત્મા સ્યાદ બ્રહ્મચારી વિવેકી ॥ ૧ ॥

डेतु थी ? एम सवाल थाय तो तेन्ता खुलायें। ए मे छे कृ-अंकल आहुरी शप्हे अं-  
कासांनुं करवुं अवा निर्षयने बहलं एक वर्भतज जमतुं एम लेय तो ए ए श्री  
वृती पडी शके छे. भूमिसंथारीमां अनतां सुधी पोसहनी एम संथादा करवे। कृ-  
चित छे. कारणुके ए श्रीनीव्याख्यामां 'भूमिए सुम्बे अने चेरिन्हा आणुवे' एम कडेल  
छे. शुक्र आण्ये पादचारीमां पें चालवुं तेविधाए पें चालवानुं समज्ञुं. अषाढुरुके  
कंतानां मोला वापरवा पडे तो शुटी वात छे पखु पगवां पडेवां ते तो तदन वर्जयज्ञ छे. कारणु के तेथी छुवयतना पणी शकती नाथी. णाकीनी शीता  
गात्रपूर्वी समजु शकाय तेवो छे.

आवा रीते ४ दी पाणीने क्षिद्धायां तीव्रे आव्या पछी पणु दरेक याना कर-  
नारे-नवाळु याना करनारे तो अवश्य छरी पाणवानी छे. तेमां शुक्र सांचे पहवारीने  
अद्देलं अंकला पादचारी समज्ञु, एटले गें चालीने याना करवी. पडी वीकु  
री तो सहजे समजु शकाय ने पाणवानी. उच्छावाणाथी पाणी शकाय  
तेवी छे, तेमज ते पाणवानी अडू पणु छे.

ए प्रभाणे ४ दी पाणीने नवाळु याना करनारे ते उपरांत बीजुं शुं शुं ह-  
रदैज करवुं अने नवाळु यानामां समुदाये शुं करवुं ते आ नीचे खतावामां  
आवे छे—

- १ हरदैज प्रातःकाळे छुवयतना अराधर थई शंके तेवे वर्भते याना करवा जवुं  
अने तीर्थराजने नेटवा. ( मुण्य उत्तिए चालीनेज याना करवी येण्य छे. )
- २ हरदैज परमात्मानी आष्टप्रकृती पूजा पेतानी शकित अनुसार उत्तम उत्तम  
दृष्टिवडे करवी.
- ३ खांच रथानके अवश्य चैत्यनंहन करवां. ( तणाटीचे गिरिराजनी आमा, प्रथम  
देशसर श्री शांतिनाथगुलुं 'आवतुं' होवाथी लां, सायणुना वृक्षनीचे लगवांती  
पाहुका छे लां, श्री पुंडिरि गणेधर सामे अने तीर्थिराज श्री कृष्णदेव  
परमात्मानी संगीपे. )
- ४ गिरिराजना शुणु भंकारी नव अमासमधू देवां.
- ५ गिरिराजनी आराधना निभिते नव दोगस्तनो शक्तिसंग्रह करवे.
- ६ अथूगने अवसरे नव रवस्तिक करी नव कृष्ण ने नव नवैव धरवा.
- ७ सूर्णनायकलुना चैत्यनी दूरती वणु प्रहस्तिला देवी.

- ८ लाभ नवारनो दृढ विसमां नृप प्ररो करवा भाटे हरदैज दृढ नवकारवाणी  
आधा पारानी ( पारा हीड नवकार गणेवा डृढ ) गणेवा.

નવાણુ યાત્રાનો અનુભવ.

૪૫

૬ સચિતત્યાગ, એકાસણું, અધ્યાર્થ, ભૂમિશાયન અને એટાંક પ્રતિકુમણું એ પૂર્વે  
૭ દ્વી માં બતાવ્યા પ્રમાણે યથાશક્તિ કરવું.

૧૦ આ તીર્થનાં નવાણું નામો પૈડી એકેક નામની એક છુટી નવકારવાળી દરરેણ  
ગણુંની. તેમાં તેના નામની સાથે ગિરિધરાય નમઃ એટલા અક્ષરો ઉમેરવા.

નવાણું યાત્રા પૂરી થતાં સુધીમાં શું શું કરવું તે નીચે પ્રમાણે—

૧ એક લાખ નવકાર ગણુંવા.

૨ પાંચ સનાત ભાષ્યાવવા. (તેના સ્થાન ઉપર વૈત્યવંહન કરવાના સ્થાન અતાવ્યા  
છે તેજ થોડ્યા જગ્યાથી છે.)

૩ એકવાર વિશેષ કંડિત નિમિસે નવાણું પ્રકારી પૂજા ઉત્તમ ઉત્તમ ૨૦થો વિશેષ  
મેળવાને ભાષ્યાવવા. તે પ્રસંગે નવાણું સ્વસ્તિક તથા નવાણું દીપક કરવા, અથવા  
નવાણું દીવેઠને એક દીવેઠ કરવેં.

૪ મૂળાનાયકજી મહાત્માજની શક્તિના પ્રમાણુમાં શ્રેષ્ઠ રીતે આંગી રચાવવી, રોશા-  
ની કરવાની, ગીતગાન કરવાનું, વાળુંનો વજાવવાં.

૫ શદ્દિત હોય તો રથયાત્રા કરાવવી.

૬ મૂળ નાયકજીના વૈત્ય ઇરતી એક સાથે ૬૬ પ્રદક્ષિણા દેવી તથા ૧૦૮ અમા-  
સમણું દેવા.

૭. એ ગિરિશરાજપર ચઢવાના એટલા માર્ગ છે તે તમામ માર્ગો કેને પાગો કહે-  
વામાં આવે છે તે ઇરસી. હુલામાં પાલીતાખૂની ચાલુ પાગ ઉપરાંત ઘેરીની  
પાગ, દૈહિશરાજાના પાગ અને શત્રુંજ્યા નહીની પાગ એ નષ્ટ પાગ ગણુંવા-  
માં આવે છે. (ઉપરાંત એક ગણુધોળાની પાગ પણ છે). શત્રુંજ્યાની પાગે ચ-  
ડતાં શત્રુંજામાંથી પાણી ગળાને દેખું અને તેનાવાં સનાન કરી તાં પગલાં છે  
તાં પૂજા કરી શત્રુંજ્યાનું જળ લઈને ચર્ચા અને તેનાવાં ઉપર મૂળાનાયકજી-  
ની પણાળ કરવી.

૮ દોદ ગાડિની, છ ગાડિનો અને બાર ગાડિની પ્રદક્ષિણા પગે ચાલીને દેવી. તેમાં દોદ  
ગાડિની નવ હુંક ઇરતોને સમય ગઢ છે તેની ઇરતી ઇરવાની છે, છ ગાડિની પ્રદક્ષિણા-  
માં ભગવાના સ્નાતજ્ઞાની ભૂમિ કેને ઉલભાનોદ કહે છે તે, અજિતનાથ ને  
શાંતિનાથજીના ચતુર્માસની ભૂમિ, ચિદ્ધાણ મુનિએ મકટ કરેલા ચિદ્ધાણ સરે-  
વરવાળી ભૂમિ અને શાંત મનુભની નિર્વિષ્ણુ ભૂમિ (બાડવાનો હુંગર) એટલા-  
ની ઇરસના થાય છે. બાર ગાડિની પ્રદક્ષિણામાં કંદંગાળિની થા-

પ્રાનેં લાલ નથે છે. ( તેટલાશેક પિંડાણું તલાવડીથી સિદ્ધ વડ પરલાયી જ-  
બાના રસ્તાચણી દળુ ગાંડની અહંકિણું પણુ કરવાનું કહે છે. )

૬ એક વાર હુંગરપૂણ કરવી. આ હુંગરપૂણ કરવાનો હેતુ નવાણું યાત્રા દર-  
ભ્યાન જે કાંઈ આશાતના ચર્ચિદ્દીય તેના નિવારલાર્થે, ગિરિરાજ પણુ પૂજનિક  
હોવાથી તેના પૂજન કરવા અર્થે તેમજ તળાયીથી માંડીને રામપોળ પર્યાત મા-  
ર્ગમાં જુદી જુદી દેશીઓમાં જે જે તોર્યકરોના અને મુનિરાજનાં પગલાં છે તે-  
મજ કાલિસંગ સુદ્રાએ પ્રતિમાએ. છે તેની પણ એકવાર પૂજન કરવી—એજણાય  
છે. આ પ્રસંગે નારદ, અયમત્તા, દ્રાવિદ ને વાલિપિલ્યએ ચાર; રામ, ભરત, શુક,  
સેવગ ને થાવચ્ચાપુત્ર એ પાંચ; જાળી, મયાળી ને ઉવયાળી એ નાચ; તથા  
દેવકીશુના છ પુત્ર એમની આંગની પૂજન કરવાનું ગાસ ધ્યાનમાં રખવા યોગ્ય છે.

૧૦ નવાણું યાત્રા કરનાર પ્રાયે એકવાર ભવાપૂણ કરે છે. તેની અંદર નવ હિવ-  
સ સુધી દરરોજ ૩૧૩ પ્રતિમાળ ને તેર તેર તિલક કરે છે એટલે દરરોજ  
૪૦૦૦ તિલક કરી, નવ હિવસે ૩૬૦૦૦ તિલક કરી તેની ખર્ણિતા માને છે.  
આની અંદર સુમારે ૨૮૦૦ પ્રતિમાળની પૂજન થાય છે. સિદ્ધાચાળ ઉપરના  
નવેનુંકનાં તમામ જિંણની પૂજન કરવામાં વધારે હિવસો થાય તેવું છે. કારણું કે  
એકાંદર ધાતુના અને આરસના માણીને નાના મોટા (સહસ્રાષ્ટ સુધાંત) સુમારે  
વીશ હજાર જિંણ છે. ઉપર જણ્ણાંયા પ્રમાણે ૩૬૦૦૦ તિલક કરવામાં સો વર્ષ.  
ના આયુષ્ણના તેટલા હિવસ થતા હોવાથી એકેક હિવસનું એક તિલક—એવી  
ગણણા કરેલી સમજવામાં આવે છે. આ પ્રમાણેની લવપૂણ કેટલીક વાર કોઈ  
યાત્રાણું આગેવાન થઈને કરાવે છે તે વરણે કેટલા કરનાર થાક તેને તે  
ધર્ણી નવ હિવસ સુધી એકાસણા કરાવે છે, પૂજા લાણ્ણાવે છે અને ચાર ચાર હા-  
નાર સ્વસ્તિક દરરોજ કરી તેનાપર બદામ તથા પતાણું વિશેર ઝણ નૈવેહ સુકે  
છે. એટલે હિવસે ૩૬૦૦૦ જાળીનો એક લાડોચો મુકે છે ને વિશેષ અદિત કરે છે;  
બાકી કેશર ફૂલ તો ફેરદ ભગપૂણ કરનારા પિતે લાવે છે.

૧૧ જાં છુદુ અને એ અદૃમની તપસ્યા કરવી. ( આ તપસ્યા કરવાની શક્તિવાળા  
માટે તે સંબંધી વિધિ તથા તે હિવસોમાં ગણુણાનું ગણુણું આ દોષમાં જુદું  
અતાવવામાં આવેલ છે. )

૧૨ ચૌવિહારો છુદુ કરીને સાત યાત્રાએ કરવો. ચૌવિહાર ઉપવાસ કરીને વણું  
યાત્રા કરવી અને આયંભિલ કરીને એ યાત્રા કરવી. આમાં ચૌવિહારો છુદું  
કરીને સાત યાત્રા કરવા સંબંધી તો શરૂંજય લણું કરવામાં એક ગાથા છે તે  
આ પ્રમાણે—

नवालु यात्रा नो अनुभव.

४७

ब्रह्मणं जत्तेण, अपाणेण तु सत्तजत्ताद् ॥

जो कुण्ड सेर्वुमि, तद्य जवे ब्रह्म सो मुखं ॥ १८ ॥

“ वे माणस पाण्डी विनानो ४३ करीने शनुंजयनी सात यात्रा करे छे ते त्रीने जवे जोक्षसुणने पाए छे.”

१३ मूर्खावाद न बोलवुं ने अदत्तादान न लेवुं ( चारी न करवी ) आ हररैजनी करणी समजवी.

१४ यथाशक्ति स्वाभीवच्छण करवुं. विशेषन घने तो नवालु यात्रा करनारा स्केहु-यात्रीनी लक्षित करवी. तणाटीचे यात्रा करीने आवनारा स्वाभीभाईच्यानी यथाशक्ति लक्षित करवी.

१५ मुनि महाराजने अवश्य हान आपवुं. आ करणी पणु हररैजनी छे.

१६ अनुकूला हान देवुं: गरीभ स्थितिना स्वाभीभाईच्याने यथाशक्ति उपष्ठं देवुं, परमार्थ प्राप्तिना साधनकूट जेने आतांच्या यातां होय तेमां यथाशक्ति सहाय देवी.

१७ ध्वनि, पताका, चामर, छत्र, कण्ठ ने थाण-अटली वस्तुओ मुक्तवी; ते उपरांत शक्ति होय तो रथ पणु मुक्तवो.

आ नवालु यात्रा आस अगवडतुं कारवु न होय तो नवालु हिवसेच्या करवी तेज घटमान छे. कारणु के तेम करवाथी तेनी संपूर्ण विधि जगवाय छे, अने लक्षित करवानो अवकाश पूरतो. भणी शके छे. एक हिवसे एकदी वधारे यात्रा करवाथी विधिमां संकेत उत्तर्वा पडे छे, लक्षितमां अवकाश आहें. रडे छे, उतावणुं यात्रावुं पडवाथी अथवा लूळि भराबर न होय तेवे वर्षते यात्रा करवा जवाथी छूव-यतना भराबर पणाती नवी. वर्षतपर श्रमितपणुं थई जवाथी यातीने यात्रा करवाना प्रथाम लभ थई डोजीमां असवाना प्रथाम थई जाय छे. उपरांत ६६ हिवस पर्यंत डेवातुं सुपानादान, पाणवातुं अक्षयर्थ, करवानो तप, अने अवश्य करवा येऊय ए टंकना प्रतिक्षमणु तेमां आमी आवे छे. तीर्थराजनी दूरसना, उत्तम मुनिराजना दर्शन अने सत्संगनो लाल पणु आण्हा हिवसेना प्रभाणुमां आहें. प्राप्त थाय छे. माटे पूरतो अवकाश मेणीनेज यात्रानो लाल लेवाना विचार राखवो येण्य छे.

वणी आ उत्तम तीर्थे यात्रा करवा आवनारे नेम घने तेम विषय क्षयातीनी भंडता करवानो प्रयत्न करवो. अहीं साढे साढे अवानी लालसा-वांच्छा न राखणी, परखी सामुं विकारदृष्टिचे जेवुं पणु नहीं, शरीरनी मुअुषा विशेषे न करवी, गो-

तगान मान परमात्मातुं ज करवुं, कोईना पर कोइय उरवो नहीं, कोइ विनाश करे के तुक्षयान करे तो तेना उपर पछु समस्ता राणवी, कोइ प्रकारतुं अभिमान करवुं नहीं, सरवताने राणगा करी दंब के गयाने तलु हेवी, दोष मान यानानो के परमात्मानी लक्षितनी इवयोः धीन न करवो, कोईनी जाये क्लेश कंकास न करवो, शुण्हाने ज्ञेहने चाल थवुं, तेनी लक्षित करवानो समय मेषववो, अनेनिरंतर आत्मानी शुद्धि विशेष याय तेम करवुः।

आ तीर्थनी आशातना धीक्षकुव उरवी नहीं, कारणु के अन्य स्थाने करेला पापतुं निवारणु तो आ तीर्थे आववाथी थर्ह शके छे, पछु आ तीर्थे ले कोई प्रकारतुं पाप यांध्युं तो तेनाथी छुटकारा थवा भाटे कोई पछु स्थान मणी शके तेम नथी. एटले तेना विषःक बहु कडवा लोगववा पठे छे. भाटे आशातना वर्जने शुद्ध अंतःकरण्याथी विधि पूर्वक-दृग्य, शून्य, अविधि अने अतिप्रवृत्ति ए चारे होष दाणाने तीर्थयाना ने परमात्मानी लक्षित करवी, जेथी आ भवमां ने परस्वमां अ-नेक प्रकारना लालनी प्राप्ति थाय.

आ तीर्थना एक हुलर नाम छोवानुं पांडित श्रीवीरविजयल कडे छे, परंतु तें कोई अंथमां वांचवामां आव्यां नथी. तेमज तेनी १०८ हुङ्क छे एटवेके जुना जुना नामवाणा शिखरो के पर्वतो छे परंतु ते १०८ नाम पछु एक साथे लगेला कोई जग्याएथी लक्ष्य थर्ह शकया नथी. अन्य विद्वानो १०८ नामो तेमना वांचवामां आव्या छोय तो ते लणी भोक्तवा दुपा करये एटले अमे प्रसिद्ध करशु. श्री शत्रुञ्जय महात्म्यमां लगे छे के श्री सुधर्मांगबुधरेव चेला महाकव्यसूत्रमांथी ए नामो जाणी लेवां (बुओ ४४ २१).

श्रीवीरविजयलकृत नवाणु भक्तरी पूजमां आ तीर्थनां हह नामो आपवामां आव्यां छे ते आ नीचे जखाव्यां छे, परंतु ते अधां जुही जुही हुकेनां नाम नथी, तेमां केटवांक तो युषुनिष्पत्त नामो भूज पर्वतनांज छोय एम जखाव्य छे. तेमानां केटवांक नामेना हेतु जखुवामां आव्या ते पछु तेनी नीचे जखाव्या छे. आटीनां नामेना हेतु पछु जेमना समज्वामां आवे ते जखुवयो तो अफर करशु.

प्रथम १०८ हुङ्के पेढी मेटी हुङ्के २१ कडेवी छे, तेनां नामो नीचे प्रमाणु छे-  
 १ विभगिरि, २ मुक्तिनिलय, ३ शत्रुञ्जय, ४ सिद्धशेष, ५ पुंडरिक-  
 गिरि, ६ सिद्धशेषर, ७ सिद्धगिरि, ८ सिद्धराज, ९ आहुषती, १० भद्रेव  
 ११ लग्नीरथ, १२ सहस्रपत्र, १३ शतपत्र, १४ अष्टोत्तरशतकुट, १५ नगा-  
 पिराज, १६ अहुञ्जुमगा, १७ छंक, १८ कोटिनिवास, १९ लोहित्य, २० ताण-

૬૫૮, ૨૧ કદંબગિરિ. આ એકવીશ નામો વિદ્યાપ્રવાહ પૂર્વચાંથી ઉદ્ઘરેલા શત્રું-  
જ્ય મહાતીર્થકલ્પમાં છે તે ૨૧ નામો પૈકી ડેટલાક તો જુદા જુદા શિખરનાં નામો  
હશે. બાકી પ્રથમના આઠ અને બીજા પણ એકજ શિખરના શુણુનિષ્પત્ત નામો  
જણાય છે.

શ્રી શત્રુંજ્ય મહાત્મ્યમાં ૨૧ નામ કહેલાં છે (જુઓ ભાષાંતર પૃષ્ઠ ૨૧-૨૨)  
તેમાંનામાંના ૧-૨-૫-૬-૭-૧૬-૧૮ વાળાં નામો નથી અને રેવતગિરિ, સુતી-  
ર્ધરાજ, કપર્દી, સહસ્રાભ્ય, પુષ્પરાશિ, સુરપ્રિય ને કામદારી એ નામો છે. આ સાત  
નામો પૈકી ત્રણ નામ દાદ સાં છે અને ૪ નામ સહજ દ્વારાંતરવાળાં છે તે નંબર  
સાથે નીચે નોટમાં ખરાવાં હતાયાં છે. \*

આ ૨૧ નામો પૈકી ૬ંડાહિ પાંચ દુંડો રાળુવન હોવાનું શ્રીવીરવિજયજી કહે  
છે. તેનું કારણું સહરસુ કલ્પમાં “દંડાહિ પાંચ શિખરોમાં દેવાધિષ્ઠિત રતનની આ-  
ણ્ણા, શુદ્ધાંશો, આંશિષિશો અને રસકુપિકાંશો વિદ્યમાન છે.” એમ કથું છે તેજ  
હશે એમ જણાય છે. વળી આ ૨૧ નામો સુર, નર અને મુનિઓએ મળીને સ્થાપન  
કરેલાં છે એમ પણ તેજ કલ્પમાં કહેલું છે. ૬ંડાહિ પાંચ નામો પૈકી તાળધ્વજ અને  
કદંબગિરિજ હાલ પ્રચિદ્ધિમાં છે, બાકીના ત્રણ શિખરાની એળખાણું પડી શકતી  
નથી. કદંબ ગણુધર કોડ મુનિઓની સાંચે સિદ્ધિપદને પામેલા હોવાથી કોડિનિવાસ  
નામતું શિખર કે જ્યાં તે કોડ મુનિઓ સિદ્ધિપદને પાખ્યા હશે તે કદંબગિરિને  
વગતુંજ હોવાનું સંભવે છે.

નવાળું પ્રકારી પૂજામાં અને તે ઉપરથી અન્યત્ર પણ દાદ નામો જે ખરાવવામાં  
આવ્યાં હોતે આ પ્રમાણે છે—

૧ શત્રુંજ્ય(૩)	૨ બાહુગંગી(૬)	૩ મર્ગદેવી(૧૦)	૪ પુંડરિકગિરિ(૫)
૫ રેવતગિરિ	૬ વિમળાચળ (વિમળાદ્રી) (૧)	૭ સિદ્ધરાજ(૮)	
૮ અગ્રિશ(૧૧)	૯ સિદ્ધકોન(૪)	૧૦ સહસ્રક્રમળ(૧૬)	૧૧ મુક્તિનિલય(૨)
૧૨ સિદ્ધાચળા(૭)	૧૩ શતકુટ	૧૪ દંડો(૧૭)	૧૫ કદંબ (૨૦)
૧૬ કોડિનિવાસ(૧૮)	૧૭ લોહિય(૧૬)	૧૮ તાળધ્વજ(૨૧)	૧૯ પુષ્પરાશિ
૨૦ મહાખાળગિરિ	૨૧ દશશિકિત	૨૨ શતપત્ર(૧૩)	૨૩ વિજયાનંદ
૨૪ લદ્રુકર	૨૪ મહાપિઠ	૨૬ સુંગિરિ(સુર્દેલ)	૨૭ મહાગિરિ(મહાચળ)
૨૮ મહાનંદ	૨૮ કર્મસુરણુ	૩૦ કેલાસ	૩૧ પુષ્પદંત

૪૪ ૫ મું રેતગિરિ છે. ૭૨ મું સુતીર્ધરાજ તે રાજરાનેશ્વર સંભવે છે. ૮૭ મું કાયદિનિવાસ  
છે. ૧૦ મું સહસ્રાભ્ય ને સહસ્રક્રમળ એક હોય તો તે ૨૧ માં પણ છે. ૧૮ સું પુષ્પરાશિ છે.  
૭૬ સું સુરકંત તે સુરપ્રિય જણાય છે. ૮૫ સું કસુક્રમ તે કામદારી જણાય છે.

૩૨ જ્યંત	૩૩ આનંદ	૩૪ શ્રીપદ	૩૫ હુરતગિરિ
૩૬ શાચિતગિરિ	૩૭ લગ્નગિરિ	૩૮ સિદ્ધશોખર(૬)૩૯ મહુજાસ.	
૪૦ માઘિબંત	૪૧ પૃથ્વેપિદ	૪૨ હુણાદર	૪૩ સુક્ષીતરાજ
૪૪ મણિકંત	૪૫ મેઢમહીધર	૪૬ કંચનગિરિ	૪૭ આનંદધર
૪૮ પુષ્યકંદ	૪૮ જ્યાનંદ	૪૯ પાતાળમૃત્ય	૫૧ વિલાસ
૫૨ વિશાળ	૫૩ જગતાર્થ	૫૪ આકલંક	૫૫ અકર્મક
૫૬ મહાતીર્થ	૫૭ હેમગિરિ	૫૮ અનંતશક્તિત	૫૯ પુરુષોત્તમ
૬૦ પર્વતરાજ(૧૫)	૬૧ જ્યોતિર્યુપ	૬૨ વિલાસલદ	૬૩ સુલદ
૬૪ અજરામર	૬૫ ક્રોમાંકર	૬૬ અમરકેત	૬૭ ગુણુકંદ
૬૮ સહુસર્પન(૧૨)	૬૯ શિવાંકર	૭૦ રમણ્ણ	૭૧ તમોકંદ
૭૨ રાજરાજેશ્વર	૭૩ લવતારણુ	૭૪ ગજયંત્ર	૭૫ મહોદ્ય
૭૬ સુરકંત(સુરપ્રિય)૭૭ અચાળ		૭૮ અલિનંદ	૭૯ સુમતિ
૮૦ એષ્ટ	૮૧ અલયકંદ	૮૨ ઉજળગિરિ	૮૩ મહાપ્રે
૮૪ વિશાળંદ	૮૫ વિજયભદ્ર	૮૬ હિંદ્રપ્રકાશ	૮૭ કપર્વીવાસ
૮૮ સુકિતનિકેતન	૮૯ ડેવળદાયક	૯૦ ચર્ચગિરિ	૯૧ આણોત્તરશતક્રૂટ(૧૪)
૯૨ સૌંદર્ય	૯૩ યોદ્ધાધર	૯૮ પ્રતિમંદ્ય	૯૫ કાસુકામ(કામદારી)
૯૬ સહાલનંદ	૯૭ મહેંદ્રધ્રબજ	૯૯ સર્વાર્થસિદ્ધ	૧૦૧ પ્રીયંકર

પ્રથમનાં ૨૧ નામો આતી છાંદર આતી જય છે. (પ્રથમનાં ૧૮ પેઢી પ મા ને ૧૩ મા શિવાયના ૧૬ અને ૨૨-૩૮-૬૦-૬૮-૬૧ એ પાંચ મળીને ૨૧)

આ નામો પેડી કે જે નામોના કારણું જાણવામાં આવ્યા છે. તે નીચે પ્રમાણે  
૧ શુક્રરાજના દ્વારા ને લાવ શત્રુઓને વિનાશ (જય) થવાથી શત્રુંભ્ય.

૨ બાહુભલિ નામના મુનિ એક હજર ને આદ મુનિરાજની સાથે મેલ્યે જ-  
વાથી બાહુભલિ. શત્રુંભ્ય મહાત્મ્યમાં બાહુભલિનાજ એક હજર ને  
આડ પુરો નિર્દ્ધિ ગયાનું કહ્યું છે.

૩ મર્દેવી માતાનું ચૈત્ય કરાવી તેમાં હસ્તતી ઉપર બેડલા મર્દેવી માતાની  
તે રૂપી મૂર્તિ પદ્ધરાવાથી મર્દેવીઃ એનો મહિમા મદા શુદ્ધ ૧૫ એ  
કરવાનો શત્રુંભ્ય મહાત્મ્યમાં કેવીએ છે.

૧૦ પરતેં—નગરીયસાળ. ૭૨ સુત થસાળ. ૮૮ મુદ્રા જંડ.

કુશતુરુંભ્ય મહાત્મ્યમાં આતીગિરિ, નાંનિગિરિ, એયાપદ, પ્રમોઃપદ, સર્કામદ, શિતિમંદા-  
મંદ, અદર્શાભ્ય, તાપાસગિરિ, શવગિરિ, ઉગાસંસુખગિરિ, રઘજગિરિ, ઉદ્યગિરિ, માર્યુદ્ગગિરિ,  
વિનેર ભીજાં નામોના પણ જાણ્યા છે.

नवाख्य थावाना अनुभव.

५१

४ मुंडरिकगण्डुधर पांच कोइ मुनि साथे थेत्री मुनमें ए तीर्थ सिद्धिपद पामेला होवाथी मुंडरिकगिरि.

५ रैवताचारा-उक्कर्यांत अने गिरनार ए त्रिशु नामवाणुं गिरनार नामथी प्रसिद्ध तीर्थ छे, ते आ पूर्वतनीज पांचमी कुँक होवाथी रैवतगिरि.

६ लगिरथले सगर यहुनीने पौत्र द्वाराते अष्टापद तीर्थ तरक्षने उपद्रवनिवारी सगर यहुनीने आ तीर्थ आवीने भज्यो तेथी, तेमज तेहु करेती गिरिराजनी लक्तिथी लगिरथ.

७ गर्भचावीशीना २४ मा तीर्थीकर ईस'प्रतिना गण्डुधर कुँब नामे आ तीर्थ सिद्धिपद पामेला होवाथी कुहंभगिरि (मुंगा पृष्ठ २००)

८ कुँब गण्डुधर साथे एक कोइ मुनि सिद्धिपद पामेला होवाथी ते शिखर ने अनुसरीने कुडिनिवास.

९ ताणधर नामना यक्षतुं निवासस्थान होवाथी ताणधरज. हाल ए कुँक ताणाळ शहुरनी पासे विद्यमान छे.

१० भरतशब्दना दुरित विगेरे आ तीर्थना महिमाथी स्वर्गे गया, तेमना येत्य भरत यहुनीमे एक शिखरपर करववाथी हस्तगिरि अथवा हस्तसेनगिरि. (मुंगा पृष्ठ २०१)

११ भरत यहुनीमे प्रथम उद्धार वर्षते लरावेला रत्नभय बिंज सगरस्यहुकीमे पवित्रम दिशामां रहेली सुवर्षु शुक्रामां पधराया तेथी कुँचनगिरि.

१२ कुपर्हियक्ष ए तीर्थीना अधिकायक थनार होवाथी भरतयहुनीमे एक शिखर पर तेनी स्थापना करी तेथी कुपर्हिवास.

१३ नभि विद्याधरनी यच्ची विगेरे ६४ पुनीमा ए गिरिपर सिद्धिपदने पामी तेथी चर्चगिरि. (श्री वीरविन्ध्यलु नवाख्यु प्रकारी पूज्यमां ए भाव लाल्या छे, अने शत्रुंजय महात्म्यमां येत्र वहि १४ शे ते स्वर्गे गए एम कहुं छे. (मुंगा पृष्ठ २०२)

१४ आ गिरिना १०८ मुण्ड शिंगरो होवाथी अष्टोत्तरशतकूट.

आ शिवाय धीमा नामे शुद्धनिष्पत्त ज्ञाय छे, तेनां आस कारण्या जाय्यवामां आव्यां नथी.

आ तीर्थे क्या क्या मुनिराज विगेरे केल्ला परिवार साथे सिद्धिपदने पाम्या ते शत्रुंजय लघुकृपमां तथा धीमा कृपमां कहेल होवाथी तेमज नवाख्यु प्रकारी पूज्यमां पछु एमानी केटकीक संख्या अतावेली होवाथी ते अहीं विस्तारथी लभवामां आ०युं नथी, तोपथु तेनी कुँक नेंद्र आगजा करवामां आवी छे. शत्रुंजय महात्म्यमां पछु जुहे जुहे त्यथे अनी संख्या विगेरे आपवामां आ०युं छे, ते आस वांचवा लायक छे.

२ अन्यव धीमा तीर्थीकर निर्वाणीना गण्डुधर एम कहेलु छे.

## શ્રી ચિદાનંદજીજી મધ્યોત્તર રસ્તમાળા॥

પ્રસ્તાવના॥

ચિદાનંદજી પહેલજ નમ્નો, ચિદાનંદજી ચુંઘાડેથ;	૧.
ચિદાનંદજી ચુંઘમાં સદ્ગ, મગન કરે તતભેન.	
ચિદાનંદજી પ્રભુની ચંદળા, ડેવળ અભિજી અનન્યાય;	
નાણે ડેવળા અનુભવી, ઉંઘથી કંઠી ન જાય.	૨.
ચિદાનંદજી પ્રભુની છૃતિ, વાર્થ ગલીએ અપારદ;	
મંદમતિ હું તેહનો, પાર ન લાણું નિસધાર.	૩.
તો પણ મુજદી મંદમતિ, તેણું તણું હિતકાજ;	
તેમજ સ્વહિત કાદણે, ચિદાનંદજી મહારાજ.	૪.
કૃતિ તેહની નિરખી, ઉત્તરમાળા ઉદાર;	
દ્વારી વિવરણ કરવા ભાષી, આત્મ થથો ઉજમાળ.	૫.
યુદ્ધબિકળ પણ ભક્તિપથ, યોધું ચુંઘકર યોલ;	
કાણું યોદે ભાગ કે, કુણું આવે તક તોલ.	૬.

શ્રી કૃપુરાંદજી અપરનાગ શ્રી ચિદાનંદજી મહારાજ આ વીશમી સરીમાંજ વિદ્યમાન હૃતા, એમ તેમની અનેક દૃતિઓથી જાણ્યા છે. આનંદઘનજી મહારાજની ચેરે તેઓથી પણ અધ્યાત્મશાસ્ક્રિય રસિક અને અધ્યાત્મતત્ત્વમાં નિયુણ હૃતા, એ વાતની તેમની કૃતિઓ સારી રીતે સારી લરે છે. તેમણે અનાવેલી દૃતિઓમાં ચિદાનંદજીની વહેંતેરી, સ્વરોદ્ધ, ચુંઘગાળીતા, છૂટક સ્વૈચ્છા તેમજ આ પ્રસ્તેનાત્તરમાળા સુધ્ય છે. તેમની બાધી કાવ્યરચના સરદ અને અર્થગંભીર જાણ્યા છે. દરેક દૃતિમાં શાલ્યમલ્લતુતિ જાણે અર્થગારવ અપૂર્વ હોવાથી તેમની સંકળણ કૃતિ હૃદયંગમ છે. તેમના પ્રત્યેક પદમાં અધ્યાત્મ માર્ગની કિપદેશ સમાયેદો છે. તેઓના શ્રી અણુંગ યોગના જારા અભ્યાસી હૃતા, તેથી તેમનામાં વિત્તમ પ્રકારસું યોગભાગ હતું, તેમજ ડેઈ અલખ પ્રકારની શક્તિ-સિદ્ધ વિદ્યમાન હતી, એમ સંભળાય છે. તેઓ તીર્થપ્રહેદ્યમાં વિશેષે વાસુ કરતા હોય એમ અનુમાન યાય છે. શાનુંજય અને ગિરનારમાં સો અસુંગ શુદ્ધ કે દ્વારાન તેમના ગવિત્ર નામથી ઓણણાય પણ છે. શ્રી નમેતશિખરાણુ ઉપર તેમનો હેઠાંત થયો છે, એવી હંતકથા ભાંભળાય છે. તેઓ બાણું નિષ્પૃણી હૃતા, એમ તેમના સંખ્યાચી સંભળવામાં આવતી કેટલીક હંતકથા ઉપરથી જિદુ થાય છે. લોકપરિચયથી તેઓ અલગા રહેતા અને પોતે જાણી

૧. અરણુકમણ. ૨. ચુંઘને હેતુ. ૩. છુંનકળ-રેખા. ૪. ડેવળાનાના અંમોદ ઉપાયદ્વારા અશ્વદ્યના. ૫. પ્રસ્તેનાત્તરમાળા.

प्रश्नोत्तर भाषा.

५३

अने सिद्धिसंपत्ति छे एम लोक लाज्येज जाण्ही शके एवी साही राते पोतांतु उपन गाणता हुता, तेम छतां काकतालीय न्याये ज्यारे कौर्झने तेवातानी जाण्हु थती त्यारे प्राप्तः पोते ते स्थान तलु ज्या हुता, तेमने अनेक सत्तशास्त्रो धरियथ हुतो एम तेमनी कृतिनु सूक्ष्म दृष्टिशी अवलोकन इनार समलू शके तेवुं छे, तेमनी वाण्ही रसाल अने अलंकारिक छे, अध्यात्म लक्ष साथे शास्त्र अस्यासमां तेमनी छोड करी शके एवो कौर्झ प्रभण पुढ़्य तेमनी पाछ्हा लाज्येज थयो लागे छे, आधुनिक छतां तेमनी थार्थशेली एवी तो अर्थज्ञाधक साथे आर्डप्पक छे के आनंदवनलुनी अहों-तेरी साथ चिदानंद अहोंतेरी अनेक अध्यात्मरसिक ज्ञनो मुक्ता कंठथी गाय छे, विशेषमां चिदानंदलुनी कृतिमां शाखरच्यना एवी तो साही छे के ते गावी बाण लुयोने पथु अहु सुखब पडे छे, ते अधी कृतिमानी 'प्रश्नोत्तरभाषा' पथु एक छे, भूज थां लघु छतां तेमां अर्थज्ञारव एटलुं अधुं छे के तेमाना एक एक प्रश्न-ना उत्तर भाटे एक एक स्वतन्त्र थार्थनी योजना समर्थ विद्वान उरी शके, भारी जेवा मन्दभृतिथी तेम अनवुं तो अशक्य छे, पथु तेनु सहज रूपद्विकरणु करवा भाटे यथाभृति उद्यम कर्त्ती छे, तेमांथी सार भाव अहुलु उरी लन्य ज्ञनो स्वपर द्वितमां वृद्धि करो, एज महाकांक्षा अने एज कर्तव्यदृप समलू प्रस्तुत प्रस्तावना समाप्त कर्त्तव्य छुं.

चिदानंदपद रसिक कर्पूर.

श्रीमत् चिदानंदश्श कृता

प्रश्नोत्तर भाषा.\* (विवेचन समेता.)

(मंगलाचरण—दोहा.)

परम ज्योति परमात्मा, परमानंद अनूपः

नमो सिद्ध सुखकर सदा, कवातीत चिद-रूपः ?

पंच महाव्रत आदरत, पालत पंचाचारः

समतारस सायर सदा, सत्ताविश गुणधारः ॥

५

\* आ प्रश्नोत्तर न्तमाणा श्री चिदानंदश्श उर्द्दे कर्पूरच्यंद्दु भद्रारजे श्री भावनगरमां रहीने संवत् १९०६ भां अनांशी छे, एम छेष्ठा कान्यथी जाण्हाय छे.

नवो प्रश्नोत्तरनो अंथ शड करवाना अद्वामां ढाल तो आ प्रश्नोत्तररत्नमाणाङ् दाखल रहीनी योग्य धारी छे.

तंत्री.

पंच समिति गुणति धरा, चरण करण गुणवास;

चिदानंद जिनके हिंसे, करुणा जाव अपार.

मुरगिरि हरि सायर जिसे, धीर वीर मंतीर;

अप्रमत्त चिह्नास्थी, मानुं अपर समीर.

३

इत्यादिक गुणयुक्त जे, जंगम तीरथ जाए;

ते मुनिवर प्रणमुं सदा, अधिक प्रेम मन आए.

४

ते मुनिवर प्रणमुं सदा, अधिक प्रेम मन आए.

५

**विवेचन—**अनंत ज्ञान—दर्शनदृष्ट लघेति जेभने जाणी छे, तेमज राग-द्रेष मोहाहिक सकण हेष भावने संपूर्ण क्षय करवाथी जेभने अनंत यारिन—  
स्थिरता शुण्य प्रगटेता छे अने तेथीज जेभनी समान आणी जगतमां यीकु डोहु  
०४६४ ज्ञानाती नसी ऐवा निरूपम श्री अरिहंत परमात्माने हुं प्रणभुं छु.  
तथा कर्म—कलायुक्ती संपूर्ण रीते सुझा थयेला होवाथी एटले हेहाहिक संपूर्ण हृ-  
पाधिथी रहित थयेला होवाथी अथमने भावे सहज रवालाविक आत्म स्वरूपने  
संप्राप्त थयेला अने आत्मार्थी जन्म ज्ञाने ऐवुंज स्वालाविक सुख प्राप्त करावी  
शके ऐवा सिद्ध परमात्माने भण्यम कडू छु. १. वाणी जे अहिंसा, सत्य,  
अस्तेय, अद्वाचर्य अने असंगतादृप पांच भावात्मोने सेवे छे; ज्ञानाचार, दर्शनाचार, चार-  
रित्राचार, तपाचार असे वीर्याचार दृप पांच आचारने पाणे छे; महासागरनी  
जेम अगाध समतारसथी लारेला छे, तथा साधु योग्य सचाविश गुण्याने सदा धारी  
राखे छे; धर्मी, भाषाहिक पांच समिति अने भन, वयन, कायानी वष्टु शुभिते, व-  
रष्टु सित्तरी (मृण शुण्य विप्रक ७० ज्ञेह) अने करण्य सित्तरी (उत्तर शुण्य संभृद्धी  
७० ज्ञेह)ने के सेवे छे, तेमज ज्ञान अने चारित्रथी पूर्ण ऐवा जेना हुद्यमां अ-  
त्यंत करुणासाक वर्ते छे; वाणी जे मेझे पर्वतनी पेरे धीर—निश्चा छे, एटले व-  
रष्टु करेली उत्तम प्रतिक्षाथी कठापि चलायमान थता नसी, सिहुनी जेवा पराकुमी  
छे, एटले कर्म शत्रुयानो नाश करवामां केशरी सिंह जेवा छे, अने सागरनी जेवा  
गंभीर छे, एटले रत्नगरनी जेम अनेक शुण्यरूपनेथी परिपूर्ण छतां लगारे छ-  
काई नहि जतां यत्नथी तेमने साचला राणे छे; तेमज पवननी पेरे अप्रतिण्ठापणे  
ऐक रथणाथी अन्य स्थेण एकांत हितने भावे अटन करता रहे छे—इत्याहिक साधु  
योग्य शुण्यावहे असंकृत होवाथी समाजममां आवानार लज्ज ज्ञाने ले चावन करे  
छे ऐवा जंगम तीर्थदृप ऐष सुनिज्ञनोने भनना अत्यंत प्रेमसावधी हुं प्रथा-  
म करु छु. २-३-४-५. आवा रसी अलिष्ट हेव शुद्धने प्रणमवादृप मंगणाचरण  
करीने हुवे आ अंधमां जे वातनुं कथन करवाहु छे ते (अभिषेय), तेनुं प्रयोजन  
तथा तेनुं इण संक्षेपथी अंधकार अणुवे छे.

प्रश्नोत्तर भागा.

५५

बाख वातकी एक वात, प्रश्न प्रश्नमे जाण;

एकज्ञात चांदे प्रश्नको, उच्चर कहुं वरवाण.

६

प्रश्नमाल ए कंउमें, जे धारत नर नार;

तास हिये अति उपजे, सार विवेक विचार.

७

**विवेचन**—जेमां लाणेगमे वातोने। सभावेश थर्थ शके ऐवी अति अगत्य-  
नी—महात्मानी वात हुरेक प्रश्नमां आवे ऐवा ११४ प्रश्नोत्तर नाभना  
थर्थमां हुं वभाषु करीश, ६. आ प्रश्नोत्तरभाण। नाभनो थर्थ ने आत्मर्थी  
अी पुझें ५ठे करशे अने तेनुं सारी रीते भनन करशे तेभना हुद्दयमां अस्यांत हि-  
तकारी विवेकविचार उपजशे, जेथी तेभने पिताने माटे भेक्षभार्ग धर्षणाज सरल  
थर्थ शकशे, ७.

प्रथम थर्थकार प्रश्नसुद्धाय क्षेष्ठे—

### प्रश्न.

देव धरम अरु गुरु कहा, सुख छुँख ज्ञान अङ्गान;

ध्यान ध्येय ध्याता कहा, कहा मान अपमान.

१

जीव अजीव कहो कहा, पुण्य पाप कहा होय;

आत्रव संवर निर्जरा, वंध मोक्ष कहो दोय.

२

हेय क्षेय फुनि हे कहा, उपादेय कहा होय;

वीथ अवोध विवेक कहा, फुनि अविवेक समोय.

३

कौन चतुर मूरख कवण, राव रंक गुणवंत;

जोर्गी जति कहो जीके, को जग संत महंत,

४

शूरवीर कायर कवण, को पशु मानव देव;

व्रायण क्षत्रिय वैश को, कहो गुरु कहा नेय.

५

कहा अधिर घिर हे कहा, डिवुर कहा अगाध;

तप जप संजय हे कहा, कवण चोर को साध.

६

अति फुर्जय जगमें कहा, अधिक कपट कहां होय;

नीच उच्च उच्चम कहा, कहो कृपा कर सोय.

७

अति प्रचंड अश्वि कहा, दो दूरदम मारंग;

विष्वंदी जगमें कहा, सायर प्रवळ तुरंग.

८

किण्ठी झरीष सर्वदा, किण्ठी मठोष धाय;

किण्ठकी संगत गुण वधे, किण्ठ संयत पत जाय.

९

चपडा तिम चंचल कहा, कहा अचल कहा सार;	
कुनि असार वस्तु कहा, को जग नरक छुवार.	१०
अंथ बधिर जग मूक को, मात पिता रिपु मित;	११
पंडित मृदु सुखी फुखी, को जगमाहे अचीत.	१२
म्होटा जय जगमें कहा, कहा जरा अति घोर;	१३
प्रबल वेदना हे कहा, कहा वक किशोर.	१४
कट्टप दृक् चित्तामणि, कामगर्वी शुं यायः;	१५
चित्रवेदी हे कहा, शुं साथ्यां फुख जाय.	१६
श्रवण नयन मुख कर जुजा, दृदय कंठ अरु जाल;	१७
इनका मंजन हे कहा, कहा जग म्होटा जाल.	१८
पाप रोग अरु फुखना, कहो कारण शुं होय;	१९
अगुचि वस्तु जगमें कहा, कहा शुचि कहो जोय.	२०
कहा मुधा अरु विष कहा, कहा संग कुसंग;	२१
कहा हे रंग पतंगका, कहा मजीरी रंग.	२२

### आतिमक प्रभात.

(आनंदधनउ महाराज अने धर्मियाणी.)

सभय प्रलातेनो छे, उपरिना सर्व व्यापारो शांत छे, जे रस्ता उपर आज्ञे दिवस अनेक लोडेनी आवाजन थती हुती, ते रस्तापर विरक जननां पगलां हेखाय छे. आकाशमां चांद भीली रह्यो छे, अने असनायाणी नलुक आवतो जय छे. अहु उद्योगी धनीयारी माथापर धार्षातुं ऐंडुं मुक्ती धार्षी जरता जय छे, अने आवे छे, तेना पगनां तुम्हरना अवाज शिवाय आआ शहेन्नी शांति अर्खं पस-रेली छे. आणी रातना उग्गराशी थाकी गयेता पहेडीर्णीदा चेतानी जगा परज ऐडा ऐडा उध देषे. अर्खं शांतिना रान्नद्यमां डोई डोई वार कुतशनो अवाज कान पर घे छे. कुकडा ऐतवा मांडुचा छे ते पाय थोडा वणत पछी थवाना आतःकाणनी याह आपै छे. पक्षीओ वृक्षपर गेत्ती लगृत थतां जय छे, अने मंद स्वरथी भक्तुर अवाज करी आनंद आपै छे.

आम अर्खं शांतिना वणतमां ऐक शांत धीर सुवान मालुज चेतानी ध-यारीभांथी लगृत थाय छे. आआ धरमां अर्खं शांति पमरी रही छे, भहेजामां डोई पछु जतनो अवाज नथी, सर्व शांत छे, आकाश निर्भण छे, हवामां जरा

१ लभनार मोतीचांद गिरधरलाल दापडीया, भा. श्य., चैत्रभेद, भी., द्वालीसीटर.

ડંડી છે. આવી પ્રગતા શાંતિમાં માત્ર લીંત પર ટાંગોના ઘડિયાળનો ચાલતો ધીમા મંબુલ સ્વર સંલગ્નાય છે, પ્રભુનામ સમરણ કરી ગંભીર પ્રદૂતિવાળો ચુવાન શાખામાં બેઠો છે, તે વખતે ઘડિયાળ પાંચ ટકોના કર્યાં. વિશિષ્ટ વર્તનવાળા મહાતમા પુરુષો અને સતીએના નામોચ્યારણું કરી તે ચુવાન શાંત વૃત્તિથી પોતાના આગલા દિવસના કાર્યપર વિચારણું કરતો હતો, પોતાના વર્તનપર નિરીક્ષણ કરતો હતો અને આત્મવિલૂચિત પ્રસારવા અને વધારવાના માર્ગપર અવલોકન કરતો હતો, તેવામાં ભાગુના ઘરમંથી અતિ શાંત, ઠંડા, મંદ સ્વરચૂક્ત ધનિ નીકળ્યો. એક મહાતમા વચોવુદ્ધ બહુ મીઠા સ્વરથી અંતરના આદૃલાદ યુવક ગાન કરતા હતા. રાગ પ્રભાતના સમયને અનુકૂળ વેલાવલ હતો. જે ગાન સંભળવાનો આપણા ચુવકને લાલ મજાયો તે નીચે પ્રમાણે હતું-

દૈ ઘરિયારી બાઉરે, ભત ઘરીય બજાવે;

નર સીર બાંધિત પાદરી, તું કંયા ઘરીય બજાવે. ॥૧॥ રે ઘરિ. ૧ ॥

કેવળ કાલ કલા કલે, વે તું અકલન પાવે;

અકલ કલા ઘટમેં ઘરી, સુજ સો ઘરી ભાવે. ॥૨॥ રે ઘરિ. ૨ ॥

આતમ અનુભવ રસ ભરો, યામે ઓદર ન ભાવે;

આનંદધન અવિચલ કલા, વિકલા કોઈ પાવે. ॥૩॥ રે ઘરિ. ૩ ॥

આ નાના પહનો તાવસુર સાથે કેમ કેમ ધનિ ઉછળતો ગયો. તેમ તેમ આપણા ચુવકનું મન તેમાં વિશેષ એકરંથતું ગયું. ગાનાર સંગિત શાસ્ત્રનો અભ્યાસી હોવાથી બહુ આસરકારક રીતે ગાન કરતો હતો. સ્વર મધ્યમ હતો, તાત અતિ આકર્ષક હતું અને શાંત સમયને અનુકૂળ લય હોવાને લીધે મનપર અસાધારણ કાળુ મેળવે તેવા હુલાલાવ ચુકત હતું. ફરેક પદનું બણે વખત પુનરાવત્તન કરતું હોવાથી સર્વ અક્ષરોની મન પર છાપ પડતી હતી, અને એકના પદ પર તો તેથી પણ વધારે વખત આરોહ અવરોધ થતા હોવાથી આરૂપ આદૃલાદ આપહું હતું.

પદ પૂર્ણ થયું અને સ્વર વિરસ્થો. આપણા ચુવકના મનપર તો આ પદની લય લાગી. તેના કાનમાં સ્વર અને પહના ધનિના પડધા પડવા મંદ્યા, અને તીવ્ય આકર્ષણી સંભળેલ પદ હુદયમાં ગાન કરવા લાગ્યું. એ પહના ભાવાર્થ પર વિચાર કરતાં કરતાં ચતુર ચુવકને આત્મજગૃત થવા લાગી. પહના લાન પર તે વિચાર કરવા લાગ્યો. તે અતિ ઉપયોગી હોવાથી તેનો કાંઈક ભાવ અત્ર ઉતારી દેવાનો પ્રયાસ કરીએ તો તે ચોણ્ય ગણાયો.

પહની પ્રથમ જાથેમાં બહુ અસૂર્ભ ભાવ સૂચવી ઉપદેશ આપ્યો હોય એમ લાગે છે. અત્ર ને હકીકત છે તે આનંદધન મહારાજ ઘડિ વગાડનારને ઉદેશીને ક-

हेता छेव एवं व्याय छे. जलांसुधी आमुनिक धर्मियाणी शोध-गोण थर्ड नं. हेती व्यासुधी राम्य लालूता माटे एक खुडिल पूर्ण पुरुषो इसे लगाउता हुता. पाण्यीशी लरेक्का एक पानमां नानो वारडो अति सूक्ष्म लिंग्युल मुक्षवामां आव-सो, अने ते लराई जाय एटदे एक घडि ( चोरीया भिनिट ) थाय एवुं भाप हतु. बहु चेक्स गणूतरी कर्नी रेत्यार इतेल पाय तथा लाटकाधी करेकी गणूतरीमां लूळ थवनो संवाच लिलकुल नहुतो. आ उपरांत थीजु पणु अनेक खुडितभा वर्षत-टाईम लघुता माटे करवामां आवती हुती. अति सूक्ष्म रक्षी लरेकी उप-रनी घडिमां रहेहुं सूक्ष्म लिंग सर्व रेतीना लाण्य पसार करी नीचे मोक्षी आप्य एवढो घडि थती. आगा रीते गणूतरी कर्नी निर्जिन करेल धर्मियुक्त जागनाप सर्वने जंहुर उन्ना माटे जावर पर भोवरीवडे टकेता मारी अनिनो उपयोग करवामां आवतो हुतो. हनु पणु क्लाइ ( अढी घडि ) जंहुर करवा माटे धाणी जगेपर जा-दसनो उपयोग करवामां आवे छे. आवा प्रादरना धर्मियाणी उद्देशीने छेवामां आवे छे के ' हे गांडा धर्मियाणी ! तुं ते शु ज्ञाते घडि वगाउतो डाईर ? मनुष्यो तो चोताने माथेज 'पाधरि' ( त्र घरि ) अथवा पावडी भाष्ये छे अने तुं घडि शामाटे घनने छे ? माटे हुवे तारा प्रयासथा विश्व ! नक्सो श्रम बांध उर.'आ-मां अलंकारसुकृत लापामां बहु उपयोगी वात उहु हो, ते ध्यान आपाने विचारवा थाय छे. प्रथम तेना स्थूल अर्थ झाव्यनी दृष्टिधी ज्ञातये छीबे. पावडी मावे बांधवानी देशाचाल प्रमाणेनी कपडानी जनावर-शण्ठ पर क्लेष छे. पावडि एटदे एक चतुर्थीश घडि याने धर्मिनो व्याचा लाग. आर्योवर्तनो रहेवाची पेताने मावे ज्ञात अने देशना नियम प्रमाणे पावडि आधे छे ए सुप्रसिद्ध हडीकित छे. ज्यारे भाषुसो पावडि आप्ये छे—पापे रागे छे लारे तुं तेथी वधारे लघुत्वा भाग-तां हो तो पण विषणुनी अधर आपनार समय वगाइ, पणु आटका लांबा अंतरे एक एक घडि वगाउ छे ते शा कामनी ? तारी प्रयास असाने छे, वगर अर्थनो छे, फ्रॉक्ट छे.

विशेष भाव ज्ञेयनो प्रयास भाव छे. अद्भुत चमत्कृतिवाणा अने अंतरना उडाणुमांया प्राह्लादां थेवेका विशाण अर्थवाणा पठनो भाव समज्ज्ञे मुश्केल छे, एटटुन नहि पणु तेना सर्व भावो अताववा माटे—समज्ज्ञा माटे के अनुभव ज्ञातये ते आस करवानी तो हनु शड्यात भाव छे.

आ काणमां मोटा शहेरोमां जतां लां वारंवार एवी इस्तिवाणा अने अंतरना आवे छे के अमुक शुक्ल ढुत्यो. करवानी धूम्या छे पणु वर्षत नथी, नानां ग्रामां-क्रमामां रवारथी सांज पल्ली थाणी वर्षत मुश्केल थर्ड पडे छे. आ गन्ने जातनी द-

## આર્થિક પ્રલાટ.

૫૬

સ્વિદમાં કહું વજુદ નથી. જેણા વખત ન હોવાની દ્વિસ્વિદ કરનારા હોય છે તે-  
 ઓઝ ધેણું વર્ષત નકામો પસાર કરનારા હોય છે. સંસારની સામાન્ય ખટપટમાં,  
 અન્યને લગતી પંચાતો કરવામાં અને પ્રમાણમાં બહુ વર્ષત કાળનારાઓઝ વર્ષત ન  
 મળતો હોવાની દ્વિસ્વિદ કરનારા હોય છે. નિયમિત કામ કરનારા માણુસો ધારે તો  
 કોઈ પ્રકારની અગવડ વગર જોઈશે તેટલો વર્ષત મેળવી શકે. એ ખાખતમાં આત્મ  
 પરીક્ષાથું કરી વર્ષત કેટલો નકામો પસાર કરવામાં આવે છે તે પર ધ્યાન પહોંચા-  
 યા વગર સત્ય સમજથે તેવું નથી. તું અન્યની નિંહા કુથથી કરવામાં અથવા શાક  
 લાવવા જેવા નકામા કામમાં કેટલો વર્ષત કાઢી નાંબે છે તે તપાસ, અને પછીને કે  
 નને ગાઈમ ગળા શકે તેગ છે કે નદિ? વર્ષતની કિંગત સાગાન્ય નથી, વર્ષત  
 એજ પિસે છે, વર્ષત એ આત્મધન છે, અને તેનાપર અંકુશ રાખનાર આ અદ્ય  
 લુચનમાં અનેક શક્યો કરી શકવા શક્તિમાન થાય છે. હુનિયાના પ્રાણીનો મોટો  
 ભાગ વર્ષતપર અંકુશ રાખવાને ખફેલે-તેની મિનિટો અને સેકન્ડોને ગળીને તેનો  
 લાલ લેવાને બાદલે કલાકોના કલાકો નકામા પસાર કરી હોય છે. આથી ધર્મિયાળ વ-  
 ગાડનારને ઉદેશીને અત્ર કહેવામાં આવ્યું છે કે મનુષ્યો પોતાને ભાગે એક ચતુ-  
 ર્ધંશુ બડિનો હિસાબ રાખનાર પાચડી બાંધે છે, લારે તું તો ચોવીશ મિનિટ એટલે  
 ચોદ્દી ને ચાળીશ સેકન્ડથી થતી લાંબી ઘડિને છેઠે જાગૃતિ આપે છે તે સમય બહુ  
 લાંબા છે, અંતર અતિ વિશાળ છે.

વર્ષતનકામો પસાર કરવાની ટેવથી બહુ હાનિ થાય છે. વ્યવહારનો એક શ્રેષ્ઠો એ-  
 અજરામસ્વત્ર પ્રાણો વિદ્યામર્ય ચ ચિત્તયેતું। ગૃહિત ઇવ કેશોષુ મૃત્યુના ધર્મમાચેરત ॥  
 જ્યારે વિદ્યા ઉપાર્જન તથા ધન ઉપાર્જન કરવું હોય લારે કફિ મરવું નથી કે વૃદ્ધ  
 થવું નથી એવો વિચાર કરવો, અને ધર્મ કરતી નર્ણત ચોટી યમરાજના હુથમાં છે  
 એવો વિચાર કરવો. આ શ્રેષ્ઠ બહુ વ્યવહાર છે, છતાં તેટલી હજ સુધી પણ આ  
 છું પહોંચી શકતો નથી. પ્રથમના વાક્યમાં રહેલી હુક્કિત તેની સંસારદ્વિને  
 લીધે તેને પસંદ પડે છે, તેથી ધન ઉપાર્જન કરતી વર્ષતે તે મરવું નથી, એમ શોહ-  
 ને લીધે માની સતત તે કાર્યમાં લાગ્યો રહે છે, પરંતુ શ્રેષ્ઠોનો ભેચતનો ભાગ ધર્મ  
 કાર્યના સંખ્યાને લગતો છે, તે સંખ્યાને તે તદ્દિન ઉપેક્ષા રાંખે છે. ધર્મ કરવાના  
 પ્રસરો મળો ત્યારે પણ વૃદ્ધાવસ્થામાં કરશું, આગળ ઉપર થઈ રહેશે, હુલ શોક છે  
 વિગેર બદ્ધના કાઢી તે તરફ લક્ષ્ય રાખતો નથી. સામાન્ય ઉપદેશની ભાવતમાં પણ  
 પોતાને ચ્યાતો ઉપદેશ મોહવથી પડી શુદ્ધ કરે છે, જ્યારે ઉપદેશનો અગત્યનો વિ-  
 ષય હુર કરી મૂકે છે, ઉચેણી મૂકે છે, ફેંડી હોય છે.

વર્ષત સામાન્ય વરતુ નથી, ગયો વર્ષત ક્રીવાર આવતો નથી, શરીર આરો-

व्य, देव युक्त धर्मनी ज्ञेगवाई, तत्त्वचित्तवन्योन्य युद्धिनिभंगता, आर्यस्त्रव विगेह-  
द्रव्य, शैन, धारा, लालने योग्य आ लवभां भलेकी अनेक ज्ञेगवाईयो लवांतरमां  
भण्डवी अति मुश्केल छे, ए सर्व हड्डीकत लवधुवामां आव्या छतां पथु प्रमादमां  
कडवाडो, दिवसो, मासो अने वरसो पसार थह ज्य, करवा योग्य कार्य कांध पथु न  
थाय, आत्मज्ञपति प्राप्त करवाना कार्यमां वधारो करवाने बढ़ते युक्तशान थाय,  
सांसारिक उपाधियोन्तु' स्वरूप लालुवा छतां तेना तरक्त अति आकर्षण्य थयान करे,  
शुल संवर डियायो कर्ती वणत प्रमाद थाय ए केटकी अवपत्ता अथवा वस्तुतः  
भूढपलु' ज्ञाने छे, ते जरा विचार करवाथी समझ शक्य तेवु छे. डेटलीक वर्षत  
आ विषयमां विचार करेणो न हेवाथी बहु गढ़लती थाय छे, तेवरा भाटे मुसुक्तु  
छवनी इरज छे के तेबु आणा दिवसना कार्यना अने तेमां ज्ञता समयनी णराखर  
तपास देवी, नांध देवी अने वणतने योग्य राते वहेंचा देवो. आशी व्यवहारित-  
चित कार्य करवा उपरांत आ लवमां करवा योग्य आत्मगृतिनां कार्य करवा  
भाटे पुरो वर्षत ज्ञर मालेहो. दृढ विचार करवा पधी केहि पथु कार्य अथवा तेने  
भाटे वर्षत मेणवयो मुश्केल नथी, ए रपत लडीकत छे. व्यवहार भाषुसो धणी-  
वार पोतानो अवाव करवा अवहित प्रयास करे छे के उपहेश देनारा के योद्धानारा  
धरश्यता हेय छे, तेथी पेटपर हाथ देरवी यीजननी मुश्केलीतो रपत ज्यात धरश्या  
वगर उपहेश आपे छे. आ हुक्कितमां कशी लौलील जेवु के हम जेवु नथी. मान  
आवो विचार मोहने लीपिज आवे छे, प्रमाद के मूढताना अंगेज ए विचार उक्त-  
ज्ञवे छे, अभी लुवना सुखमां जेवु वचन हेयज नहीं ए योक्स लडीकत छे.  
हिंडी प्रधान लोई मोर्ली ज्ञेया विद्रान तरीके लाल्याता छे तेयेह दरेक मतुष्यने कांध  
न णनी शके तो हररेज अरव्या कडाक यारा वांचन भाटे काठवानो आथह करतां  
समज्ञवे छे के ज्ञेया वर्षत मेणतो नथी ऐवी इरियाद करनारा हेय छे तेयेनो  
भाग तो वर्षतने इंडी देनारज हेय छे. डेईक मालुसने सांसारिक अथवा  
गृहनी स्थिति असाधारण्य राते विरुद्ध वर्तती अथवा काठणो आपनारी हेय छे,  
तेना शिवाय मोटा लागना भाषुसो यीन्तु' कांध न णने तो तपास करीने शोधी का-  
डेली युक्त हररेज मान अरव्या कडाक वाचे तो योडा वर्षतमां तेनामां असाधारण्य  
भगजण्णा, केवत अने व्यवहारहक्षपथु' आवी ज्य छे.

शरीरनो अरोंसे नथी, भरवुं चाकम छे, तेनो चाकस समय लवधुवामां नथी  
गरती वर्ष वर्षतुओ अन मुक्ती ज्ञानी हो, ए सर्व हड्डीकत ध्यानमां लधरे  
धरीमाथी पडती रेतीना हरेक दरेक कछुनो उपयोग करवा युक्तभाषाराज तो शिक्षा  
आपे छे, उपहेश आपे छे, आथह करे छे, के वस्तुनी प्राप्ति भाटे प्रयास करी रह्यो

આત્મિક પ્રભાત.

૬૨

એ તેણું સ્વરૂપ વિચાર, તેણો સંબંધ વિચાર, તેણું સ્થિરપણું વિચાર, છતાં તારો આગ્રહ છુટી શકતો ન હોય તો તે પ્રાસ કરવાના પ્રયાસમાં ઓડો વખત કાઢ, પણ કાંઈક ઈચ્છાનો અવરોધ કર, સંસારથોડાને તહેન છુટા મુક્કી દેમા, તેણી લગામ તારા હાથમાં રાખ. આ સર્વ કરવાનો મુખ્ય સ્ફોર એવ છે કે તારા આખા હિવસમાં કાર્યનો નિયમ કર, તે માટે જતા સમયને માપ અને તારું પ્રોથમ-કાર્યક્રમ નજીવી કર, અને નજીવી કરેલા કાર્યક્રમ પ્રમાણે વર્તવાનો દઠ નિશ્ચય કર. ધડિ વગાળનરકલાકે કલાકે ઘણર આપે છે કે તેટલો વખત પસાર થઈ ગયો, તારું આચુષ્ય તેટલું એછું થયું, એ વિચારી તું કલાકની મિનિટો અને મિનિટની સેકન્ડોનું માપ રાખ, તેણો ઉપયોગ કર, તારી ઈચ્છા સાંસારિક હુશે તો આ નિયમથી તારામાં એવું નિયમિત પણું આવશે કે તને સાંસારિક કાર્યો કરવામાં પણ સુગવહતા થશે, હિવસને અતે અમૃક કાર્યો કરવું રહી ગયું એમ કહિ થશે નહિ, અને તે ઉપરાંત તને આત્મિક વિતવન કરવા, નવીન શુલ્ષ સંપત્તિ પ્રાસ કરવા, એકઠી કરેલી અશુલ્ષ સંપત્તિ હુર કરવા, અને છેવટે નિરંતરને માટે શાંતિથી એસવા માટે જે વખત કુજલ પડને જેઠાં તે તું બહુ સુગમ રીતે કોઈ પણ પ્રકારની સ્થૂલ કે સૂક્ષ્મ અગવડ વગર મેળવી શકીશે.

આપણો ચુવક વિચારધારા આગળ ચલાવતો જય છે, સ્થિતિ આ પ્રમાણે છે, એ રૂપી જાણવા છતાં જીવ સાંસારિક કાર્યો કરતી વખતે તન્મય થઈ જય છે, ધાર્મિક-આત્મિક કાર્ય કરતો વખતે વખતને સંકોચ થતાવે છે, કરે છે તેપણું એન્રમાન છોડતાને ધારમાતા રમાટે તેમ અંતર્થી હુર રાખી કરે છે. આ સર્વ જીવની અનાદિ મૂહૂર્ત, પાદગિલિક રાગાંધાતા અને માહુવસાતા જતાવે છે. પ્રથમ ગાથામાંપાદી શાખાપર જે શાખાલક્ષાર બતાઓયે છે તે બહુ વિચારવાચોયાય છે. એ સૂચાવે કે છે પા ધડીનો પણ લારોંસોનથી, જેની સાથે અત્યારે વાતચિત કરતા હોઈએ છીએ તે સવારમાં ચાલ્યા જય છે, તું પણ ચાલ્યો જવાનો છે, માટે વસ્તુસ્વરૂપ વિચારી આત્મતરપ શોધના પ્રયાસ કર, અને તેમ કરવા માટે પ્રાસ થયેલ સમયને ઉપયોગ કર. શારીરિક સંપત્તિ સારી હોય તારે કાંઈ વિશિષ્ટ કાર્ય થઈ શકે છે, ધાર્દ્રિયા શિથિલ થઈ જય, ડોડી હુલવા માંડે, શારીરણ તુટવા માંડે તે વખતે તો રાખજ પણી શકશે, અને તે વખતે સમય, અતુરૂપતા, જેગવાઈનો લાલ ન લેવા માટે પસ્તાવે થશે; પણ પછી પાણી ગયા પછી પાણ બાંધી શકશે નહિ, બાંધવાનો વિચાર કરીશ તે મૂર્ખાઈ ભરેલું લાગશે; અત્યારે તારો વખત છે, એડાજ સ્વાર્પણુથી જે કરી શકીશ તેથી તને અભિષ્યમાં મેટો લાલ મળશે.

ચુવક આ પ્રમાણે વિચાર કરતો હુતો તેવામાં તેણે પોતાની જાતમાં કાંઈક સ્વર્પ-

પ્રકાશ પડ્યો, મુહગલ ને આત્માની વિસ્તા જેવાંમાં આવી, આત્મદ્વારાપજ પોતાનું છે એમ લાગવા માંડ્યું. એ લયમાં ને લયમાં પદની થીણ ગાથાપર વિચાર કરવા લાગ્યો. ‘અહો ! આ ઘડિયાળી તો માત્ર આધ્ય કામ જણ્ણવવા માટે પ્રયાસ કરે છે; પરંતુ એને થીણ આંતરમાં રહેલી ન કણી શકાય તેવી કણાની પ્રાપ્તિ થતી નથી, એ અકણ કાળાને જણ્ણવનારી ઘડિ તો આંતરમાં રહેલી છે અને હવે મને તો તેજ ઘડી પસંદ ગાવે છે.’ આ પદમાં ખડુ અદ્ભુત લાવ સૂચાંયો છે. ધન્ય શુરૂમહારાજ ! સંપત્તિ પ્રાપ્ત કરવા આ લુચ પર્વતે પર્વત આથડે છે, ફાંટાદાર શેઠીઆઓની સેવા કરે છે, પોતાના વણાણુ કરે છે અને અનેક નીચ કુયુકિયેં. કાશે લગાંદે છે. એથી વધારે આગળ ચાદી ધર્મસંપત્તિ પ્રાપ્ત કરવા કોઈ પણ પ્રકારના વિવેક વગર, વિચાર વગર, હેતુના જાન વગર આ લુચ તુંંગે રુંગે, મંહિરે મંહિરે અને નહીંએ, સર્વોવરે, જંગલે, આશ્રમે આથડે છે. તેને એમ લાગે છે કે ધનસંપત્તિ પેઢે આત્મસંપત્તિ પણ બહારથી લાવવાની છે, પણ વસ્તુતઃ તેમ નથી. તાર્દ છે તે તારી પાસે છે. તારામાં છે, તુંજ છે. કેની શોધમાં વિવેક વગર તું રમણ્યા કરે છે તેને એણાખ, તેનું સ્વરૂપ સમજ, તેનાપરસો કંચદો કાઢી નાખ, અને જરા જો. તને જણુણે કે શુદ્ધ, નિરંજન, નિરોષિક કંચન તુંજ છે, તાર્દ સ્વરૂપ તું પોતે જાણતો નથી, એણાખાંતો નથી, સમજતો નથી, સમજવા પ્રયાસ કરતો નથી. તું તારા સમયને—વળને બરાણર અંદુશમાં લઈ જરા આંતરચન્દ્ર ગોલ, અને પછી જો કે તારી કોઈ વસ્તુ બહાર લેવા જવી પડે તેમ નથી.

આધ્ય વસ્તુની પ્રાપ્તિ કરવા અને તેને મેળવવાનું માર્ગે શોધવામાં આ લુચ નકામો કાળાંશેષ કરે છે. વસ્તુસ્વરૂપ અને આત્મદ્વારાનો તેની સાથેનો સંબંધ એકવાર વિચારે તો તેને તુરત જણ્ણાય એમ છે કે પ્રથમ તો એ વસ્તુ શોધવા પાછળ પ્રયાસ કરવોન મિથ્યા છે, તે હદ સુધી ન પહેંચાય લાંસુધીને માટે પણ એ વસ્તુ બહાર શોધવા જવી પડે તેવું છેજ નહિ. કે જેઠાં તે તારી પાસે છે. બહારના પ્રયાસથી કે ડેઈની મહેરણાનીથી વસ્તુપ્રાપ્તિ થઈ છે, એમ માનતાર ભૂસ ખાય છે. મયણુંદરીના પિતા એમજ માનતા હતા, અને વસ્તુસ્વરૂપ સમજનારી મયણુંદરીની સુખુદ્વિપર રાજસેવકો હસતા હતા, જ્યારે સુરસુંદરીની તારા કેવી બુદ્ધિને વળાણુતા હતા; પણ તેજ સુરસુંદરી જ્યારે નાનીને દેશે આવી અને સર્વ અમ હર કોઈ લારેજ આત્મિક દ્રવ્યની અને તેના દ્રવ્યતની કિમત થઈ. એટલો વખત ધૈર્ય ન રહે તેથીજ હનીયામાં ધણી વળત ગફલતી થાય છે, હનીયાના વળાણ જરા માણુસો ઘડિયાળીની માઝક બાધ્ય વસ્તુ ઉપરાજ રાચનારા હોયછે, આંતરસ્વરૂપ સમજ તેનું મજૂર કારણ શોધનારા બહુ થોડા હોયછે.

## आतिमिक प्रभात.

६३

तेटवा माटे तुं तारूं चोतानुं स्वदृप विचार. तुं कौषु ? क्यांथी आ०ये ? तारूं कौषु ? तारूं के हाय ते तारूं नथी एम कहि न थवुं जेधेय, एम थाय तो ते तारूं नथी के तारां नथी, एम समज. तुं चोते धन नथी, धनवान नथी, ते सर्वने गतिमां मुकनार लेपथी तेने तारा चोताना समझनार पशु भरी रीते तुं चोते एकलो, अण्ड अनंत ज्ञान हर्षन चारिनाहि अनंत शुण्युक्त चिदानंद-धनभय स्वदृप निख छे, तारूं ते स्वदृप शुद्ध स्वदृप छे, ते पर भेल काढव क्यरो अद्येय छे, तेथी तुं ते स्वदृप जेतो नथी, लाषुतो नथी, लाषुवानो प्रयास करतो न-थी, ए अंधकार दशामां धन, ओ, हेह, पुन, भित्र डे औल वस्तुओने तुं तारी चोतानी भने छे, ए प्राथमिक भूतने लीधे भूत परांपरा चाले छे, अने तने वारं-वार गबडाये छे, रणाये छे, इसाये छे, तेथी तुं हवे तारूं शुद्ध स्वदृप एण्ठाहो ते प्रास करवा निश्चय कर. प्रास करवानुं कांध नथी, वधारे स्पष्ट रीते कृष्णे तो ते प्रगट करवा निश्चय कर. तारे कैर्पासेथी लेवा ज्वानुं नथी, सुवर्ष्णपर घेल भेलने धर्तीने काढो नाख्वानो छे, एटले प्रकाशभय हीव्य कंचनत्व के तारामां भ-रेहुं छे ते प्रगट थशे, अने तने अव्याधाध सुख प्रास थशे. ए कंचनत्व प्रगट करवा माटे अजिन विजेते साधननी ज़दर छे, तेटवा पूरती खाल्य निमित्तानी ज़दर छे, तेने विवेक पूर्वक साधन तरीके आहर.

युवान विचार करे छे के—भियारो धियाणी तो खाल्य धियाण वगाऊया करे छे, पशु आतिमिक अनंत शक्तिने भतावनार धडि तो अंदर रहेती छे. आ आ-द्य धडि तो स्थूल समय खातावी ते नकेमां न गाणवा माटे प्रेरणा करे छे, पशु अंतरंगमां रहेती धडि अकाये छे, तेनाथी अनंत सुख प्रास थाय तेवुं छे, अने ते चोतानी वस्तु छे, तेथी भने तो तेज धडि पसंद आवे छे, खाल्य वस्तुतुं स्वदृप भराभर लाषुवामां आ०या पठी सुज माण्डीने तेना तरइ ग्रीति थती नथी. वस्तुतत्वे हे चेतन ! विचार. तुं नवां सुख शोधे छे लां सुख जेवुं कशुं छे ? सुंदर लोक्न आवामां डे सारां कपडां पडेवामां डे श्रीसंघेगमां सुख शुं छे ? हुनियामां सुख जेवुं कांध नथी, लागे छे ते सुखनी पछवाडे पशु मदा हुणना दुःखरो लायी छे, मान्यतानुं सुख पशु क्षणिक छे; क्षणिक छे तेटदो वणत पशु थीजां अनेक हुणो अनुभवमां अने नजरमां खरां रहेलां होय छे. आवी झ्याली कडपनापर रचायलां सुणेना गोटा भंडाल्यनुं स्वदृप लाषुवा पछी तने ते भेजवना धन्दा थाय छे ? एमां सुख शुं छे ? तें विशेष सुख शुं छे ते लाषुवुं नथी, अनुभव्युं नथी; तेथीज तने क्षुद्रक सुखनी मान्यतापर प्रेम थाय छे. तारे अ२म सुखनो आनंद चाणवो हाय तो एक वगत तुं

ભરતાબદ્ર સામાયક કર, ઘર સ્વી વિગેરે લૂલી જા, વૈરાગ્યના અપૂર્વ વિષયમાં તારી ભનોવાસનાને લદ્યાં કરી જે, પછી જેણે; તેની મીઠાશ તને આપો દિવસ લાગયો, એવી રીતે સ્વાધ કરેલ સુખનું સ્વરૂપ સમજુ તે વિશેષપણે મળે, વધારે વખતને માટે મળે, અને છેવેં નિરંતરને માટે મળે એવો પ્રયાસ કર. એ પ્રયાસ કરવામાં સાધનધર્મનું સારી રીતે અવદાન કર. નિમિત્ત વગર હિથા થી-કાર્ય થણું તારે માટે હણું સુશ્કેલ છે. ન્યારે તારું અહસ્યુત વીર્ય સ્ફુરશે ત્યારે તો તારે અન્ય નિમિત્તની અપેક્ષા નથી, હાલ તો એવા નિમિત્તની-આદ્ય અવલાંખનોની તારે જરૂર છે, તેથી વિવેક પૂર્વક અવદાનન લેતો જ. તેમાં પણ સાધનને સાધ્ય માની કેવાની લૂલ થઈ ન જય, તેથી ચેતતો રહેણે. વાકરણુથાખનો અલ્યાસ બાકરણું ભાતાર નથી પણ ભાવાસન Literature ના સરલ વાંચનાને સમજણું માટે છે, દેવપૂજા આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે છે, એ નિયમ તું સર્વથા ધ્યાનમાં રાખને. આવી રીતે સાધનદ્વારા પ્રાપ્ત કરેલ સુખ તને બાહુ આનંદ આપશે. એક વખત તેની વાનકી ચાણીશ પછી તને બાહ્ય સુખપર પ્રેમ થશે નહિ. આ સર્વ સુખને ખતાવનાર અને તેને પ્રાપ્ત કરવાના માર્ગ ખતાવનાર અંતર ઘડી તારા હૃદયમાં ભરેલી છે, તેનાપરજ હવે તને પ્રીતિ થવી કેનાઓ. કારણું કે તું હવેસમજું શક્યો છે કે: આદ્ય સ્વરૂપ તદ્દન ઉપર ઉપરનું અને આટે માર્ગ દોરનારું છે. એના મોહમાં પહેલ પતંગ પાતાનું આચુપ્ય નકારું પૂર્ણ કરે છે. જોઈ હિશામાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે, પૌદ્રલિક વાસનાએ તુસ કરવા માટે અને વ્યવહારમાં કર્મ ગણ્યાવાના ભૂલ ભરેલા ધ્યાલથી આ લુલ ઘડિ ઉપર ઘડિ પસાર કરી લુલન પૂર્ણ કરી નાખે છે, પરિણામે હોય તેથી પણ ભારે થાય છે, અને નિરંતર સાંસારમાં રખજા કરે છે. એ તારું કર્તવ્ય નથી, એ માર્ગ તારે પસંદ કરવા ચોય નથી, એથી તને બાહુ હાનિ છે; તેટલા માટે આંતર ઘડિનેજ હવે તું પસંદ કર.

અપૂર્વ.

સુનિ સુદરસુરિકૃત.

અન્યાન્યાત્મા કલ્પદ્રમ.

અન્યાન્યાત્મિક વિષયનો અતિ ગાઢન ચંચ.

વિસ્તારથી વિદેશન કરનાર.

ભોગીચંદ્ર ગિરધરલાલ કાપરાચા,

ચોગીચાટર, બી. એ. એલ. એલ. બી.

શુષ્ઠ કુલં છસે ઉપર, દીમી આદ પેણ. કિમત ભાત નામની રૂ. ૧-૪-૦  
ટ્રેનાં અર્થ જુદું.

શ્રી કેન ધર્મ પ્રસારક સલા—ભાવનગર.

२-२ श्री डाइरी गोपाल मठन  
 १-४ शा शातिलाल कस्तुररथं ह  
 १-४ शा भद्रु राजमाण  
 १-४ शा डाकेरदास क्षेत्रचं ह  
 १-४ शा लकुलाई हरीचं ह  
 १-४ शा तुणजराम पानाचं ह  
 १-४ शा हीराचं ह हेवचं ह  
 १-५ देशी वीरलु लीमल  
 २-८ शा हरभचं ह परधमान  
 २-८ शा भुद्र माणल  
 १-४ शा हरलुवन डायालाई  
 १-४ शा नाथालु सुभाल  
 १-४ शा धरभचं ह ताराचं ह  
 १-४ शा हरीचं ह कुलचं ह  
 १-४ अंधवी लकुलाई साकरचं ह  
 २-८ शा अवा वेलाल  
 २-८ शा चुनीलाल देसलचं ह  
 १-४ शा. भनलु लारभलु  
 १-४ शा. मेतीचं ह पहमशी  
 १-४ शा. अवचं ह नानालाई  
 १-४ शा. हीरलु भुलु  
 १-४ शा. सुखलाल हांस्तीलाल  
 १-४ शा. लकुलाई रामल  
 १-४ शा. भनसुभ वरभतचं ह  
 १-४ शा. मेतीचं ह शुलाभचं ह  
 १-४ शा. मेहनलाल लक्ष्मीचं ह  
 १-४ शा. हरेवावन वरधमान  
 २-८ शा. राजलु इकीरल  
 २-८ शा. एठालाई नरोत्तमहा  
 २-८ कहाई हेमचं ह हरलुवन  
 ३-१२ शा. छगनलाल कस्तुररथं ह  
 १-१२ शा. सुगचं ह सुरचं ह

१-१४ शा. नानचं ह लाधीचं ह  
 १-४ टोणीया अलेचं ह नेठालाई  
 १-४ वारीया हयाण कीका  
 १-४ संतोकचं ह नीभवहास  
 १-५ शा. सुगचं ह मगनलाल  
 १-४ शा. अगीचं ह कुलचं ह  
 १-४ शा. कुलचं ह हीराचं ह  
 १-५ शा. लगालु राजल  
 २-८ शा. नाथालाई सुभलाई  
 २-८ शा. अबालाल महिलाल  
 १-४ शा. नानचं ह वालल  
 १-४ शा. मातीचं ह उंगरसी  
 १-४ शा. सुगचं ह माला  
 १-४ शा. काला गला  
 २-८ शा. हेमचं ह हरीचं ह  
 १-१० शा. चुलाखचं ह जेवनल  
 १-४ सुनिशी अभरविजयल लाईष्ट्री  
 १-४ शा. रतलु डायालाई  
 १-४ शा. डायालाई लकुलाई  
 १-४ शा. डायालाई कुगरु  
 १-४ शा. लेचं ह मलुकचं ह  
 १-४ शा. नरधलु सुलल  
 १-४ शा. लगवान लवल  
 १-४ शा. टेकचं ह मेतीचं ह  
 १-४ शा. लीमाल कानाल  
 १-४ शा. हीराचं ह आघुंदल  
 १-४ शा. मगनलाल रवचं ह  
 २-८ शा. गीगा वालल  
 २-८ शा. मगनलाल लकुलाचं ह  
 २-८ शा. अवाणु कमाल  
 ३-१४ शा. कस्तुरचं ह प्रेमचं ह  
 १-१० शा. उदालु वरधमाल

३-१२ शा. छाटालाल सुणयंद	३-१२ शा. छाटालाल सुणयंद
१-४ शा. मोहुकयंद पानयंद	१-४ शा. हयाराम बेचरदास
१-४ शा. सरूपयंद गोवनलु	१-४ शा. मनसुभ डायालाई
१-४ सुनिश्चीक्षुरविजयलु नैनशाण्या	१-४ शा. लाइकयंद वीरयंद
१-४ संघनी लालबलु पीतांधर	१-४ शा. कुशाळ कलालु
१-४ शा. कानालु रपालु	१-४ शा. नथुलाई केठालाई
१-४ शा. द्वीयंद प्रेमयंद	१-४ शा. पुरुषोत्तम ललुभाई
१-४ शा. दुंगर मेहलु	१-४ शा. हीरालु लुवालु
२-८ शा. वीसनयंद ज्ञानयंद	२-८ शा. छाटालाल मगनलाल
२-८ शा. छाटालाल कपुरयंद	२-८ शा. ज्ञेताराम सांडणयंद
१-४ शा. पीतांधर भाषुकयंद	१-४ शा. मउलु जेरालु
३-१२ शा. अभृतलाल लालयंद	१-४ शा. अमिलु जेरालु
१-४ महेता प्रेमयंद करसनलु	१-१२ शा. डासदलाई जे मल
२-८ शा. तलइयंद दृपयंद	२-८ शा. हंसराज लधा
१-४ शा. सुणलु धनलु	१-४ शा. पुरुषोत्तम अमररथी
१-४ शा. रतनयंद नागरदास	१-४ शा. बावयंद रतनरती
१-४ शा. हुरगोवन डेवगदास	२-८ शा. बदामीहास सरूपयंद
२-८ शा. चुनीलाल काणीहास	३-१४ शा. ललुभाई देवयंद
३-१४ शा. देवराय सुणलु	१-४ शा. वीरयंद गणेश
१-४ शा. व्रीसावनदास छगनलाल	१-४ शा. हुरभयंद जे ठालु
०-४ आस्तर दुंगरशी चन्द्रलज	२-८ शा. दासेहर आपुशा
१-४ शा. अभृतलाल छगनलाल	१-४ शा. लीणालाई मानयंद
१-४ शा. प्रेमयंद हीरायंद	१-४ शा. डेवगदास भारवाडी
१-४ शा. हीरायंद नेमयंद	२-८ वोरा चुनीलाल लालयंद
१-४ शा. उमीमीसिलु लालसिलु	१-४ शा. प्रेमयंद उज्जम
१-४ शा. भोटीलाल हुरगोवनदास	१-४ शा. देवयंद जे यंद
१-४ शा. वनेयंद देवीयंद	१-०-४ शा. धनराजलु ईंदरयंदलु
३-१२ महेता लुतमल डेसवलु	३-१२ संघनी लाइकयंद चन्द्रलज
१-०-४ शा. चुनीलाल हुंभडरलु	१-४ शा. शीरयंद हरभयंद
१-४ शा. करसन दुंवरलु	१-४ शा. नररीहास देवराज
१-४ शा. लीभालु लगवानलु	२-८ शा. खालाराम वीरयंद
२-८ शा. महीकरणु मगनीराम	२-८ शा. रतनरती वरधमान